

ડેલ્ટા+ની UK, US, રશિયા અને ભારત સહિત 9 દેશોમાં હાજરી

PAGE NO. 18

સ્વદેશ

પરદેશમાં દેશની મહેક એટલે

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH



ભારતને હરાવી ન્યૂઝીલેન્ડ બન્યું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન

PAGE NO. 19

FRIDAY, 25 JUNE, 2021 Vol. 18, No. 26 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

આર્ટિકલ 370 નાબૂદી બાદ પીએમના નેતૃત્વમાં કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ વચ્ચે પહેલીવાર સંવાદ

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળશે: મોદી

ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થતાં જ વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે

નવી દિલ્હી

આર્ટિકલ 370ને રદ કરાયાના બે વર્ષ બાદ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પહેલીવાર જમ્મુ-કાશ્મીરની ૮ રાજકીય પાર્ટીઓના ૧૪ નેતાઓ સાથે સીધો સંવાદ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જમ્મુ-કાશ્મીરના નેતાઓ વચ્ચે સાડા ૩ કલાક ચાલેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં ડિલિમિટેશનની પ્રક્રિયા, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો, વિધાનસભાની ચૂંટણીઓ જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરાઈ હતી. બેઠક બાદ કેન્દ્રીયમંત્રી જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં બધાને સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે, ડિલિમિટેશનની પ્રક્રિયા બાદ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જમ્મુ-કાશ્મીર શાંતિ તરફ આગળ વધી રહ્યું છે, લોકોમાં નવી આશા છે.

બેઠક બાદ અપની પાર્ટીના નેતા અલતાફ બુખારીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાને તમામ રાજકીય પાર્ટીઓને ડિલિમિટેશન પ્રોસેસમાં સામેલ થવા અપીલ કરી છે. અમને આશ્વાસન અપાયું છે કે ડિલિમિટેશન વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરશે. વડા પ્રધાને એમ પણ જણાવ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે. ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થતાં જ ચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, બેઠકમાં અમે જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક રાજ્યનો દરજ્જો આપવા સહિતની પાંચ માગ

કોંગ્રેસે કરી આ 5 માગ

- જમ્મુ-કાશ્મીરને ઝડપથી રાજ્યનો દરજ્જો આપવામાં આવે
- જમ્મુ-કાશ્મીરમાં તાત્કાલિક વિધાનસભાની ચૂંટણી યોજાય
- કેન્દ્ર સરકાર બાંધકામ આપે કે જમ્મુ-કાશ્મીરના લોકોની જમીન અને રોજગારની સુવિધા તેમની પાસે જ રહે
- 30 વર્ષથી રાજ્યની બહાર વસતા કાશ્મીરી પંડિતોનું તાત્કાલિક પુનર્વસન કરવામાં આવે
- તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવે

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More info on PAGE 2
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM



પીએમ મોદી @ એ ગ્લાન્સ

જમ્મુ-કાશ્મીરથી દિલ્હી અને દિલ્હી વચ્ચે રહેલું અંતર દૂર કરવા માગું છું ■ જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયા મજબૂત બનાવવા પર સરકારનું મુખ્ય ધ્યાન ■ જિલ્લા વિકાસ પરિષદોની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણી અમારી પ્રાથમિકતા ■ જમ્મુ-કાશ્મીરની જનતાના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની આવશ્યકતા ■ કાશ્મીરમાં થતું એકપણ મોટ અત્યંત પીડાદાયક હોય છે, યુવાપેઢીની સુરક્ષા સામૂહિક જવાબદારી

રજૂ કરી હતી. પીડીપીના નેતા મુઝફ્ફર હુસૈન બેગે જણાવ્યું હતું કે, બેઠકમાં તમામ નેતાઓએ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માગ કરી હતી. જવાબમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પહેલા ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થવા દો પછી અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. કોંગ્રેસના નેતા ગુલામ એહમદ મીરે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ બધા નેતાઓને સાંભળ્યા અને કહ્યું હતું કે, ચાલો આપણે આગળ વધીએ.

દક્ષિણ સાસ્કેચવાન પાસે શાળામાંથી બાળકોના કંકાલવાળી કબરો મળી

વાનકુંવર

કેનેડાના દક્ષિણ સાસ્કેચવાનમાં ફર્સ્ટ નેશનમાં વધુ એક નેટિવ બાળકો માટેની ભૂતપૂર્વ રેસિડેન્શિયલ સ્કૂલની સાઈટ પરથી સેંકડો અજાણી કબરો મળી આવી છે. કાઉનેસ ફર્સ્ટ નેશન અને ફેડરેશન ઓફ સોવરિન ઈન્ડિજિનિયસ ફર્સ્ટ નેશનના એક નિવેદન અનુસાર કેનેડામાં અત્યાર સુધીની અજાણી કબરોમાં આ નોંધપાત્ર છે. ત્રણ સપ્તાહ અગાઉ ફર્સ્ટ નેશને સાસ્કેચવાન પોલિટેકનિકની અંડરગ્રાઉન્ડ રિસર્ચ ડિટેક્શન ટીમ સાથે જોડાણ કર્યા બાદ કબરોના અવશેષો મળી આવ્યા છે. પાછલા મહિને પણ ૨૧૫ બાળકોનાં અવશેષો મળી આવ્યા હતાં જેમાંના કેટલાંક બાળકો ત્રણ વર્ષનાં હતાં અને તેમને બ્રિટિશ કોલોમ્બિયાના કામલૂપ નજીકની એ સાઈટ પર દાટવામાં આવ્યાં હતાં જે સાઈટ પર એક સમયે કેનેડાની સૌથી મોટી ઈન્ડિજિનિયસ રેસિડેન્શિયલ સ્કૂલ આવેલી હતી. મારિયેવલ ઈન્ડિયાના રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે મળેલી કબરો અંગે વધારે વિગતોની રાહ જોવાઈ રહી છે.



અત્યાચારના કારણે ૬૦૦૦ બાળકોનાં મોત

આ બાળકોને જબરદસ્તીથી ક્રિશ્ચિયન બનાવાયાં હતાં અને તેમની સ્થાનિક બોલી બોલવાની પણ મંજૂરી ન હતી. આ શાળામાં ઘણા બાળકો પર અત્યાચાર ગુજારાચો હતો અને તેના લીધે ૬૦૦૦ જેટલાં બાળકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે.

SUPER VISA INSURANCE

Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRRP | RETIREMENT PLANNING

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Need mortgage financing?
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada
bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069
Serving Greater Toronto Region Fax: 416-253-9461

Residential
New Condos
Investments
Commercial

દુઆમાં યાદ રાખરો

Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office: 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: patelzakir82@gmail.com

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

Avni Shah
B.A., JD
Barrister & Solicitor
ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1



કેનેડામાં પ્રવેશ કરતાં પ્રવાસી માટે નિયમો હળવા કરાયા

વેક્સિનેશન પૂરું કરનારને જ એન્ટ્રી મળશે : નેગેટિવ રિપોર્ટ હોય તેવા પ્રવાસીઓને હવે ક્વોરોન્ટાઇન થવું પડશે નહીં

ઓન્ટેરિયો : કેનેડામાં સરકારે ચોક્કસ શરતોને આધિન દેશમાં પ્રવેશ કરતાં ટ્રાવેલર્સ માટે નિયમો હળવા કર્યા છે. હવેથી વેક્સિનેશન પૂરું કરનારને જ એન્ટ્રી મળશે. કેનેડાના નાગરિકોના આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરવા કેનેડા સરકારે ઉપલબ્ધ ડેટા અને વૈજ્ઞાનિક પૂરાવાનું સતત નિરીક્ષણ કરી દેશમાં કેનેડાના નાગરિકો, કાયમી રહેવાસીઓ, તથા ભારતીય કાયદા હેઠળ રજિસ્ટર્ડ લોકોના પ્રવેશ માટે એક જવાબદારીપૂર્ણ અને સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. કેનેડા સરકારે જાહેરાત કરી હતી કે, તે કેનેડામાં પ્રવેશ કરનારાઓ માટેના નિયમોને હળવા કરવા જઈ રહી છે. એટલે કે કોવિડ-19નો નેગેટિવ ટેસ્ટ ધરાવતા વેક્સિન લઈ ચુકેલા ટ્રાવેલર્સ કેનેડાની જમીન અથવા હવાઈ માર્ગે દેશમાં પ્રવેશી શકશે તેમજ તેમને ક્વોરોન્ટાઇન થવાની જરૂર રહેશે નહીં. આ સાથે કેનેડા સરકારે સ્પષ્ટતા કરી છે કે, જે લોકોએ ફાઈઝર, મોડેર્ના અથવા એસ્ટ્રાજેનેકાના બન્ને ડોઝ મેળવ્યા છે અથવા



તો જેનસ્સેનનો એક ડોઝ મેળવ્યા છે તેવા નાગરિકોને સંપૂર્ણ વેક્સિનેટેડ થવા હોવાનું માનવામાં આવશે. 5 જુલાઈ, 2021થી કેનેડામાં કાયમી ધોરણે પ્રવેશ કરી રહેલા વેક્સિન મેળવી ચુકેલા ટ્રાવેલર્સ ક્વોરોન્ટાઇન થવાની અથવા 8માં દિવસે કોવિડ-19 ટેસ્ટ કરવાની જરૂર રહેશે નહીં.

ઈન્ટરગવર્નમેન્ટલ બાબતના મંત્રી ડોમિનિક લીબ્લેકે જણાવ્યું હતું કે, કેનેડા આવનાર મુસાફરો સરહદ પર આવે તે અગાઉ એરિવકેન એપ પર તેમની વેક્સિનેશન લગતી માહિતી રજૂ કરવી જરૂરી બનશે. અલબત્ત, નવા પગલાંનું પાલન કરવું જરૂરી બનશે, વેક્સિન મેળવી ચુકેલા ટ્રાવેલર્સ આગમન અગાઉ અને આગમન સમયે ટેસ્ટિંગ સહિતના અન્ય કેટલાક આવશ્યક પગલાંનું પાલન કરવું જરૂરી બનશે. જો કોઈ વ્યક્તિ કોવિડ-19નો નેગેટિવ ટેસ્ટ ધરાવે અને સંપૂર્ણપણે વેક્સિન મેળવી લીધી હોય તો તેવા સંજોગોમાં ક્વોરોન્ટાઇન થવા, સરકારની અધિકૃત હોટેલમાં રોકાવા તથા આઠમા દિવસે કોવિડ-19 ટેસ્ટ કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત જેઓ કોવિડ-19 વેક્સિન માટે યોગ્યતા ધરાવતા નથી તેવા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અથવા આંશિક પ્રમાણમાં વેક્સિનેટેડ થવા હોય તેમણે ટ્રાવેલને લગતા નિયંત્રણોનો સામનો કરવો પડશે.

ઓન્ટેરિયોમાં અનલોકના બીજા ચરણનો ૩૦મી જુનથી આરંભ થવાની સંભાવના

વેક્સિનેશનનો આખરી તબક્કો શરૂ થઈ ગયો, પર્સનલ કેર સર્વિસ અને આઉટડોર મેળાવડાઓ શરૂ થઈ શકશે

ટોરોન્ટો : પ્રિમીયર ડગ ફોર્ડ ઓન્ટેરિયોના અર્થતંત્રને ફરીથી ધમધમતું કરવા માટે અનલોકના બીજા ચરણનો પ્રારંભ ૩૦મી જુનથી કરાવવા માંગે છે એમ સુત્રોએ જણાવ્યું હતું. જો કે એ અંગેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં જ લેવાશે. જો બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો ૩૦મી જુનથી એનો અમલ શરૂ થઈ શકશે. જેમાં પર્સનલ કેર સર્વિસ અને આઉટડોર મેળાવડાઓ શરૂ થઈ શકશે. ઓન્ટેરિયો પહેલા ચરણમાં પ્રવેશ્યું એના ૨૧ દિવસ બાદ એટલે કે, બીજી જુલાઈથી એનો અમલ થાય એવી યોજના હતી. પરંતુ પ્રિમીયર ફોર્ડને આ પ્રક્રિયા ઝડપી બનાવવાનો વિચાર આવતા તેમણે વહેલું શરૂ કરાવ્યું હતું. તેમને ખરેખર તો ભાવિ ત્રણ સ્ટોપવાળો સકારબોરો સબવે એક્સટેન્શન ટોરોન્ટો પ્રોજેક્ટ જલદીથી શરૂ થાય એની જાહેરાત પણ કરવી હતી. એટલે બીજા ચરણના આરંભ માટે ઉતાવળ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોવિડ -૧૯ના કેસોમાં ઓન્ટેરિયોમાં મોટો ઘટાડો પણ જોવા મળ્યો હોવાથી આપણે બીજા ચરણથી ત્રીજા ચરણ



સુધી સલામત રીતે પહોંચી શકીશું. ખરેખર તો મંગળવારે જ વેક્સિનેશનનો આખરી તબક્કો પણ શરૂ થઈ ગયો હતો. જેને કારણે હવે આર્થિક પ્રવૃત્તિઓને પણ છેલ્લા થોડા અઠવાડિયાથી વેગ મળી રહ્યો હતો. ફૂલ વસતિના ૧૮ વર્ષથી વધુ વય જૂથના ૭૬ ટકાને વેક્સિનેશન પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે. જ્યારે ૨૫ ટકાનું વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. જો કે, પ્રાંતના આરોગ્ય અધિકારીઓ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, આગલા ચરણમાં પ્રવેશવા કમસે કમ ૨૧ દિવસની રાહ જોવી પડશે. ફોર્ડે કહ્યું હતું કે, ઓન્ટેરિયોના ચીફ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. ડેવિડ વિલિયમ્સ અને હેલ્થ મિનીસ્ટર ક્રિસ્ટીન ઈલિયોટ હાલમાં કોવિડ -૧૯ની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યાં છે. જેના આધારે જ રીઓપનિંગનો નિર્ણય લેવાશે.

ટોરોન્ટોમાં ઉનાળામાં સામાન્યથી વધુ ગરમી અનુભવાશે : હવામાનશાસ્ત્રી

ટોરોન્ટો : ટોરોન્ટોમાં ઉનાળાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. રવિવારથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી અને આ વર્ષે ટોરોન્ટોમાં નાગરિકોને સામાન્યથી વધુ ગરમીનો અનુભવ થશે એમ એન્વાયરમેન્ટ કેનેડાના વરિષ્ઠ હવામાનશાસ્ત્રી ડેવ ફિલિપ્સે જણાવ્યું હતું.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં રવિવારે સવારે કહ્યું હતું કે આ તો માત્ર શરૂઆત છે. આપણને હવે ખબર પડી ગઈ

ચાલુ મહિનામાં જ ગરમીનો પારો વધુ ૩ ડીગ્રી ઉંચે જવાની સંભાવના

છે કે, ઉનાળા માટેના કયા પીણાં કેવી રીતે તૈયાર કરવાના છે અને પંખા અને એરકંડીશનીંગ કેવું રાખવાનું છે. આ વર્ષે ટોરોન્ટોનો ઉનાળો ગરમી અને બફારાવાળો રહેશે. તાપમાનનો પારો ૩૦ ડીગ્રી સુધીનો રહેશે. આ વર્ષે કુલ છ દિવસ અત્યાર સુધીમાં ૩૦ ડીગ્રીથી વધુ તાપમાન રહ્યું છે.

હજી આ મહિનામાં જ તાપમાનમાં વધુ ૩ ડીગ્રીનો વધારો થઈ શકે છે જે સામાન્યથી વધુ હશે.

આ આવનારા જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ માટેનું મોડેલ છે જે હજી કદાચ વધુ ગરમીવાળા માસ બની રહેશે. આપણે ઉનાળાની છેલ્લા બાર વર્ષ પહેલાની સ્થિતિ જોવી

જોઈએ. જો આપણને સામાન્ય અને એથી ઠંડો ઉનાળો જોઈતો હોય. એટલે હવે જે સ્થિતિ છે એને સ્વીકારવી જ પડે

એમ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મારા મતે તો આ ઉનાળો ગોલ્ડીરોક્સ બની રહેશે. જે વધુ ઠંડો પણ નથી અને વધુ ગરમ પણ નથી. ટોરોન્ટો આ વર્ષે કદાચ સામાન્યથી વધુ વરસાદ પણ જોઈ શકશે. કેનેડાના હવામાન વિભાગ મુજબ રવિવારનું તાપમાન ૨૮ ડીગ્રી હતું પણ ગરમી ૩૦ ડીગ્રી જેવી લાગતી હતી.

૧૪ માસમાં પહેલીવાર ટોરોન્ટોના આઈસીયુમાં કોવિડનો દર્દી નહીં

ટોરોન્ટો ધી યુનિવર્સિટી હેલ્થ નેટવર્ક (યુએચએન) દ્વારા આ સમાચાર બુધવારે સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૬મી માર્ચ, ૨૦૨૦થી કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરનારી મેડીકલ સર્જિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં

ઓન્ટેરિયોમાં કોવિડના દર્દીના હોસ્પિટલાઈઝેશનમાં મોટો ઘટાડો નોંધાયો

હતું કે, ટોરોન્ટો જનરલ હોસ્પિટલના એમએસઆઈસીયુ માટે આવું પહેલીવાર બન્યું હતું કે, એક પણ કોવિડ-૧૯નો દર્દી નહીં હોય.

અમે હોસ્પિટલની ટીમ માટે ગૌરવ અનુભવીએ છીએ. આ આભારની નોંધ સાથે હોસ્પિટલે પોતાના કર્મચારીઓ આ અવસરને તાલીઓથી વધાવી લેતા હોય એવો વિડીયો પણ મુક્યો હતો.

સ્ટાફના એક સભ્યે કહ્યું હતું કે, તમારી સખત મહેનત માટે તમે અભિનંદનના અધિકારી છો. હું તો ખુશી પર જ રડી પડીશ એવું લાગે છે. આજે જાણે આપણે કોવિડ મુક્ત બન્યા હોઈએ એવું લાગે છે. એક દિવસ પહેલા જ ટોરોન્ટો વેસ્ટર્ન હોસ્પિટલે જાહેર કર્યું હતું કે, તેઓ કોવિડ-૧૯ વોર્ડ બંધ કરી રહ્યાં છે. ચેપી રોગોના નિષ્ણાંત ડો. અબ્દુ શાવ્વે કે જેમણે આ હોસ્પિટલમાં સેવા આપી હતી તેમણે કહ્યું હતું કે, ટોરોન્ટો

વેસ્ટર્ન હોસ્પિટલે જાન્યુઆરી ૨૦૨૦થી અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના ૧૬૮૮ દર્દીઓની સારવાર કરી હતી. મહામારીના ત્રીજા વેવની સર્વોચ્ચ સ્થિતિ વચ્ચે ઓન્ટેરિયોમાં કોવિડ-૧૯ના દર્દીઓના હોસ્પિટલાઈઝેશનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે અહીં ૮૦૦ દર્દીઓ આઈસીયુમાં સારવાર લેતા હતા.

ઓન્ટેરિયોમાં પ્રવાસનને પ્રોત્સાહન માટે પ્રવાસીઓને પોઈન્ટ કાર્ડની ભલામણ



ટોરોન્ટો

ઓન્ટેરિયોના ટૂરિઝમ સેક્ટરને રાહત આપનારા સમાચાર આવ્યા છે. સરકારે બુધવારે જાહેર કરેલા ડિસ્કાઉન્ટ કાર્ડ અને જાહેરાતોથી એ સ્પષ્ટ થાય છે. સરકારના ટૂરિઝમ ઈકોનોમિક રીકવરી મિનીસ્ટ્રીયલ ટાસ્ક ફોર્સે આ વર્ષના બજેટની જાહેરાતમાં જણાવ્યું હતું કે, મહામારી બાદના સમયમાં પ્રવાસન સેક્ટરને ઝડપથી બેઠું કરવા ટાસ્ક ફોર્સે ૧૦ મહત્વની ભલામણો કરી હતી. જે પૈકી પ્રવાસીઓને પોઈન્ટ કાર્ડ આપવાની ભલામણના આધારે ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવશે. ટાસ્ક ફોર્સના વડા ટીમ

હુડાકે કહ્યું હતું કે, ઓન્ટેરિયો ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી પોતાના બધે આગળ વધવાની ક્ષામતા ધરાવે છે. કેમ કે, લોકોને પણ સાહસિક પ્રવાસોનો આનંદ માણવાની ઉત્સુકતા છે. એટલે સ્થાનિક સ્તરે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આવી ઓફર મહત્વની બની રહેશે. વળી, લોકોને પણ સલામત પ્રવાસની ખાતરી પણ મળશે. વન ટાઈમ પેમેન્ટ ટાસ્ક ફોર્સે સરકારને ભલામણ કરી હતી કે, ઓન્ટારીયન્સ માટે ડિસ્કાઉન્ટ કે ટ્રાવેલ પોઈન્ટનું પ્રોત્સાહન આપવું જોઈએ. જેથી લોકો પ્રાંતમાં પોતાના ગમતા સ્થળોનો પ્રવાસ કરી શકે. પોઈન્ટસ કાર્ડ

2020-2021ના બજેટમાં ઓન્ટેરિયો ટૂરિઝમ રીકવરી પ્રોગ્રામ અંતર્ગત 100 મિલીયન યુએસ ડોલરની જોગવાઈ થઈ હતી

મોબાઈલ એપમાં આપી શકાશે. અહેવાલમાં જણાવ્યું હતું કે આવી યોજના પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ અને યુકેના લંડનમાં ચાલી રહી છે. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ના બજેટમાં સરકારે આને માટે ઓન્ટેરિયો ટૂરિઝમ રીકવરી પ્રોગ્રામ અંતર્ગત ૧૦૦ મિલીયન યુએસ ડોલરની જોગવાઈ કરી છે અને ૧૦૦ મિલીયન યુએસ ડોલરની જોગવાઈ ટૂરિઝમ બિઝનેસને ગ્રાન્ટના રૂપમાં આપવાની પણ જોગવાઈ છે. વર્ષ ૨૦૨૦ના બજેટમાં સરકારે ૧૫૦ મિલીયન યુએસ ડોલરની જોગવાઈથી ૨૦ ટકાની યોગ્ય સબસીડી જાહેર કરી હતી.

કોરોનાની બીજી લહેર અંત તરફ, નવા 401 કેસ, 10 મોત

એક્ટિવ કેસની સંખ્યા 9536, 535ની હાલત નાજૂક

ઓન્ટેરિયો : કેનેડામાં કોરોના વાયરસની બીજી લહેર હવે અંત તરફ જઈ રહી છે. ગુરુવારે આખા દેશમાં 24 કલાકમાં માત્ર 401 કેસ નોંધાયા હતા. જો કે, આ દરમિયાન 10 દર્દીના કોરોનાને કારણે મોત નિપજ્યા હતા. ગુરુવારે સાંજની સ્થિતિએ કેનેડામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 9536 નોંધાઈ હતી. જ્યારે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 535 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. મળતી વિગતો મુજબ ગુરુવારે સાંજ સુધીના વીતેલા 24 કલાકમાં કેનેડાના ઓન્ટેરિયોમાં સૌથી વધુ 296

દર્દી વાયરસથી સંક્રમિત હોવાની પૃષ્ઠિ થઈ હતી. જ્યારે ઓન્ટેરિયોમાં આ જ સમયમાં 6 દર્દીના મોત નિપજ્યા હતા. દિવસ દરમિયાન અહીં 384 કોરોનાગ્રસ્તો વાયરસમાંથી મુક્ત થયા હતા. આ ઉપરાંત ક્યુબેકમાં ગુરુવારે નવા 96 કેસ નોંધાયા સાથે ચાર દર્દીના મોત નોંધાયા હતા. મોનીટોબામાં આજે નવા 106 નાગરિકો વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. મોનીટોબામાં કોરોનામાં સપડાયેલા બે દર્દીના મોત થયા હતા. જ્યારે સાસ્કેચવાનમાં આજે વધુ 52 લોકો વાયરસની ચપેટમાં આવી ગયા હતા.

ઓન્ટેરિયોમાં ડેલ્ટા વેરિઅન્ટનો ખોફ : હોટસ્પોટ વિસ્તારમાં વેક્સીનના બીજા ડોઝને વહેલી મંજૂરી

30મી મે પહેલાં વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોય, તેઓ બીજા ડોઝ માટે સ્લોટ બુક કરાવી શકશે

ટોરોન્ટો : ઓન્ટેરિયોના ડેલ્ટા વેરિઅન્ટના હોટસ્પોટ વિસ્તારોમાં રહેનારાઓને કોવિડ-19ની વેક્સીનનો બીજો ડોઝ ઝડપથી અપાઈ શકે એના માટે ઓનલાઈન બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. ટોરોન્ટો, પીલ, હેલ્ટન, પોર્ક્યુપીન, વેલિંગ્ટન-ડફેરીન-ગુરેફ, વોટરલૂ, યોર્ક, હેમિલ્ટન, સિમકોએ-મસ્કોકા અને ડરહામ જેવા વિસ્તારોને આવરી લેનારા આરોગ્ય કેન્દ્રોને હોટસ્પોટ જાહેર કરાયા છે. આ વિસ્તારના લોકો જેમણે 30મી મે પહેલાં વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોય, તેઓ

બીજા ડોઝ માટે સ્લોટ બુક કરાવી શકશે. ઓનલાઈન બુકિંગ માટેનું પોર્ટલ સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ ગયું હતું. ફાઈઝર બાયોટેક અથવા મોર્ડેનાનો પહેલો ડોઝ લેનારાઓ માટે બીજા ડોઝની શરૂઆત પ્રાંતમાં આવતા અઠવાડિયે કરવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે. શરૂઆતમાં બ્રને ડોઝ વચ્ચેનું અંતર ચાર માસનું રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. પરંતુ વેક્સીનનો જથ્થો વહેલો મળી જવાની શક્યતાને જોતા બીજો ડોઝ ઝડપથી અપાય એવા પગલા લેવામાં આવી રહ્યાં છે.

કેનેડામાં શાળાઓ ખુલવાથી કોવિડનો કોઈ જ ખતરો નહીં : અભ્યાસમાં તારણ



ટોરોન્ટો

કેનેડાએ હાથ ધરેલા શાળાઓ શરૂ થવાથી કોવિડ -19નો ખતરો છે કે નહીં એ વિશેના અભ્યાસનું તારણ બહાર આવ્યું છે. અભ્યાસનો વિષય અત્યારના સમયમાં કોવિડ -19ના સંક્રમણ સામે શાળાઓ કેટલી સલામત છે તે હતો. વાનકુવર સ્કુલ ડિસ્ટ્રીક્ટના ૧૭૦૦થી વધુ શાળાના કમચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ત્રણ માસ સુધી ટેસ્ટીંગ થયું હતું. એમના બ્લડ ટેસ્ટ અને કોવિડ -19ની એન્ટીબોડીની તપાસ પણ થઈ હતી. જે બાદ તારણ

કેનેડાના અધિકારીઓ શાળાઓ ક્યારે ફરીથી શરૂ કરી શકાશે એ નક્કી કરવા માંગતા હતા. અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, શિક્ષકગણ પૈકી માત્ર ૭ને ઈન્ફેક્શન હતું. જે કદાચ મિત્રો કે, સમાજમાંથી પણ આવ્યું હોઈ શકે. માત્ર સ્ટાફના ૫ લોકો એવા મળ્યા જેમને શાળામાં સંક્રમણ લાગ્યું હતું. અભ્યાસનો મુખ્ય આધાર એ હતો કે, મોટી સંખ્યામાં સ્ટાફ, શિક્ષકો અને

શાળાઓમાં બીજા તબક્કામાં સંક્રમણનું જોખમ એકદમ ઓછું હોવાનો તબીબોનો મત

વિદ્યાર્થીઓના એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એસિમ્પટોનિક કેસ અને સિમ્પટોનિક કેસ બંનેનો અભ્યાસમાં

શામેલ કરવામાં આવ્યા હતા. એન્ટીબોડી ટેસ્ટથી ખ્યાલ આવે છે કે, જેમને સંક્રમણ લાગ્યું હોય તેઓ સારવાર બાદ કેટલા સ્વસ્થ અને સુરક્ષિત બની શક્યા છે. એમની રોગપ્રતિકારકતા વધી છે. અન્ય સ્થળોની સરખામણીમાં શાળાઓમાં સંક્રમણનો ખતરો સૌથી ઓછો છે. બ્રિટીશકોલંબિયા કેનેડાના એવા પ્રાંતો પૈકીનો એક છે જ્યાં મહામારીને કારણે શાળાઓ બંધ નહોતી રખાઈ.

શામેલ કરવામાં આવ્યા હતા. એસિમ્પટોનિક કેસ અને સિમ્પટોનિક કેસ બંનેનો અભ્યાસમાં

વેક્સીનેટેડ ન હોય, તેવા બાળકોના પ્રવાસ પર પ્રતિબંધને પગલે કચવાટ

ટોરોન્ટો

કેનેડાની ફેડરલ સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પરના પ્રતિબંધો હટાવી લેવાના પ્રથમ તબક્કાની આ અઠવાડિયે જે જાહેરાત કરી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેની લાયકાત માટે વેક્સીન ફરજિયાત છે અને પરમેનન્ટ રેસીડેન્ટસ અને કેટલાક વિદેશી નાગરિકોને ફરજિયાત હોટેલ ક્વોરન્ટાઈનથી મુક્તિ આપવાનો સમાવેશ થાય છે. પરંતુ પાછા ફર્યા બાદ તેમણે ટેસ્ટીંગ કરાવવું પડશે અને વય મર્યાદા મુજબ આઈસોલેશન પણ પાળવું પડશે. આ નવા નિયમનો અમલ પાંચમી જુલાઈથી થશે. જેમાં વેક્સીન ન લીધી હોય તેવા બાળકોને હોટેલ ક્વોરન્ટાઈનથી મુક્તિ અપાઈ છે. પરંતુ ટેસ્ટીંગ ફરજિયાત છે. જો કે વાલીઓ બાળકોના આઈસોલેશન દરમિયાન

ઘરમાંથી બહાર જઈ શકશે. આ જાહેરાત બાદ કેનેડીયન્સમાં હતાશા, રોષ અને વિરોધ જોવા મળ્યો હતો. હેલ્થ મિનિસ્ટર પેટી હાજડુએ કહ્યું હતું કે, જેઓ વય મર્યાદાને કારણે વેક્સીન લઈ નથી શક્યા. એમનામાં કોવિડ-19ના સંક્રમણની સંભાવના રહે છે. એટલા માટે સાવચેતી રાખવી જરૂરી છે. તેથી વેક્સીનેટેડ લોકો માટે જ પ્રવાસની મંજૂરી આપવામાં આવી રહી છે. હેલ્થ કેનેડાએ જણાવ્યું હતું કે, નવા વેરિઅન્ટના સંક્રમણની સંભાવનાને કારણે આ પગલું લેવામાં આવી રહ્યું છે. એટલે ૧૪ દિવસનો ક્વોરન્ટાઈન અને આઠમાં દિવસે ટેસ્ટ ફરજિયાત છે. ઘણાં એવું માને છે કે, નવા નિયમને કારણે બાળકોવાળા પરિવારો પ્રવાસ નહીં કરી શકે. એટલે આ નિયમથી લોકો અસમંજસમાં મુકાયા છે.

THINKING OF INVESTING?

INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects plus your investment is secured against the assets.

INVEST WITH Metrobuild Capital Sharia'h Compliant

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

CALL 416 893 4585 TODAY!!!

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX CROSSROADS REALTY INC. #SellWithABOWATH your Local REALTOR

*Not intended to Solicit client under contract.

કથા, હવન, ગાયત્રી યજ્ઞ, વાસ્તુ પૂજન, ગ્રહશાંતિ,

જીટીએમાં દરેક જગ્યાએ અમો સેવા આપીએ છીએ.

શશીકાંત ભટ્ટ

૯૦૫ ૪૫૬ ૭૬૨૨

કાલસપ્તે યોગ શાંતિ, નક્ષત્ર શાંતિ, વગેરે ધાર્મિક કાર્યો અને લગ્ન, બેબી શાવર, જેવા કાર્યો માટે સંપર્ક કરો.

Shashikant Bhatt

Home: 905-456-7622

Cell: 416-258-2750



તંત્રી સ્થાનેથી

કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતને માથે વધુ એક ચિંતા

પોષ્ટા બે વર્ષથી સમસ્ત દુનિયામાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસના જુદા જુદા સ્વરૂપ સમયાંતરે દેખાયા છે. મેડિકલ એક્સપર્ટ્સ કોરોનાને મોસ્ટ કન્ફ્યુઝિંગ વાઈરસ કહે છે. એટલે કે, આ વાયરસ પર સતત નજર રાખીને તેને મારતા રહેવું પડે છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે માંડ માંડ થાળે પડી રહી છે. જોકે, આમ છતાં દેશને માથે હજી કોરોનાની ત્રીજી લહેરનું જોખમ મંડાયેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને ભારત વિશે રજૂ કરેલા બે જુદા જુદા તારણોમાં એકમાં તો કોરોનાની બીજી લહેર મંદ પડ્યાની વાત કરી છે. પરંતુ બીજી બાજુ નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ખતરનાક સાબિત થઈ શકે તેવી ચીમકી પણ આપી છે. બીજી લહેરમાં વાયરસનું જોર ચરમસીમાએ હતું ત્યારે ભારતમાં દરરોજ ચારથી સાડા ચાર લાખ કેસો નોંધાતા હતા. જે ધીમે ધીમે ઘટીને પચાસ હજારની અંદર આવી ગયા છે. ત્રીજી લહેર પહેલાં નિષ્ણાતોએ આપેલી સલાહ અનુસરવા જેવી છે. ભારતમાં લોકો અને પ્રદેશની સરકારો કોરોનાના કેસોનો આંકડો જોઈને સાવચેતી સાથે બાંધછોડના પગલા લઈ લે છે. પરંતુ કોરોનાનો જે નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ છે એ અત્યારે તો મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો છે. ગુજરાત એ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને અડીને આવેલું હોવાથી ખાસ ચિંતાનો વિષય બને છે. નવા વેરિઅન્ટનો ગુજરાતમાં ગમે તે ઘડીએ પ્રવેશ થઈ શકે છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અગાઉના ડેલ્ટા વેરિઅન્ટના સ્પાર્શક પ્રોટીનમાં મ્યુટેશનથી બન્યો છે. બીજી લહેરમાં જે લોકો કોરોનાનો ભોગ બન્યા હતા, તેનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ જ હતો. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ વિશે હજુ મેડિકલ એક્સપર્ટ્સને પણ પૂરી જાણકારી નથી. તેઓ કહે છે કે, આ વેરિઅન્ટ વિશે હજી અભ્યાસ ચાલુ જ છે.



તંત્રી - પ્રકાશ સ્વદેશ

જોકે, ડેલ્ટા પ્લસ અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી પ્રસરતો હોવાની આશંકા છે. આ વેરિઅન્ટ કેટલો જીવલેણ છે એ સ્ટડી પછી જ ખબર પડશે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારત ઉપરાંત બીજા નવ દેશ અમેરિકા, બ્રિટન, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાં પણ જોવા મળ્યો છે. આ બધા દેશ નવા વેરિઅન્ટ સામે સતર્ક થઈ ગયા છે. હવે નિષ્ણાતોએ જે ઉપાયો સુચવ્યા છે તે પ્રમાણે જ્યાં પણ આ નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જોવા મળે એ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન ડિક્લેર કરીને મૂવમેન્ટ બંધ કરી દેવી જોઈએ. હવે સૌથી મહત્વની વાત તો એ છે કે આ વેરીએન્ટના ખાસ કોઈ લક્ષણો નથી. એટલે દર્દીને કે આરોગ્ય ખાતાને નવા વેરિઅન્ટની ખબર પડે અને તમે એનો રસ્તો બંધ કરો એ પહેલાં તો એનું સંક્રમણ ક્યાં સુધી થઈ ગયું હોય છે. આ જોખમના કારણે તેની ઓળખ ઝડપી કરવી પડશે. આમ તો અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના માત્ર ૪૦ કેસો જ મળ્યા છે. પરંતુ આ ૪૦માંથી ચાર હજાર કે ચાલીસ હજાર કેસ થઈ જતા વાર લાગે તેમ નથી. આથી કોરોનાના આ વેરિઅન્ટની ઓળખ કરવા માટે દેશમાં ૨૮ લેબોરેટરીનું એક કંસોર્ટિયમ બનાવવામાં આવ્યું છે. આ લેબોરેટરીમાં ૪૫ હજાર સેમ્પલની જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી હતી. ડેલ્ટા વેરિઅન્ટની ઓળખ પણ આ રીતે જ થઈ હતી. કોરોનાને રોકવા માટે અત્યારે વેક્સિનેશન જ ઉત્તમ ઉપાય છે. યોગ દિવસથી ભારતમાં વોક ઈન વેક્સિનેશન મહાઅભિયાન શરુ થઈ ગયું છે. પહેલા જ દિવસે એટલે કે સોમવારે ૮૬.૧૬ લાખ ડોઝ વેક્સિન આપીને ભારતે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જોકે

બીજા દિવસથી જ વેક્સિનેશનના કામમાં ઘટાડો નોંધાયો છે. સરકારે વેક્સિનેશનના કામમાં ઝડપ બરકરાર રાખવી પડશે. હવે કોરોનાની વેક્સિન અસર ન કરે એવો કોઈ વેરિઅન્ટ આવશે તો? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળને કેન્દ્ર સરકારે પત્ર લખ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટ અત્યારે ૮૦ દેશોમાં છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ૯ દેશોમાં જોવા મળ્યો છે. અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન, નેપાળ, રશિયા અને જાપાનમાં પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળ્યું છે. આ વેરિઅન્ટ કદાચ બહુ જીવલેણ નહીં હોય. એ બહુ ઝડપથી ફેલાતો હોવાની શંકા હોવાથી કદાચ દેશમાં ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

વર્તમાન સમયે દેશમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં રત્નાગિરિમાં સૌથી વધુ ૮ કેસ છે. ત્યારબાદ જલગાંવમાં ૭, મુંબઈમાં ૨ અને પાલઘર, થાણે અને સિંધુદુર્ગમાં એક-એક કેસ નોંધાયા છે. કેરળમાં પલક્કડ અને પદાણમિથિતમાં કુલ ત્રણ કેસ સામે આવ્યા છે. એઈમ્સના ડોક્ટર શુભદીપ કર્માકરે જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસમાં વધારાનો ૬૪૧૭૭ મ્યુટેન્ટ છે, જે ડેલ્ટાને ડેલ્ટા પ્લસમાં ફેરવે છે. આ મ્યુટેન્ટ વધુ ચેપી છે. તે આલ્ફા સંસ્કરણ કરતા ૩૫-૬૦% વધુ ચેપી છે, તેવી અટકળો ચાલતી હોવાનું તેમનું કહેવું છે. જોકે, ભારતમાં તેની સંખ્યા ઓછી છે.

ભારતમાં આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, દેશમાં રિકવરી રેટ ૯૬ ટકા પહોંચી ચુક્યો છે. વી.કે. પોલે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિનેશનની ઝડપ સારી છે. જ્યારે કોરોના વારંવાર રૂપ બદલી રહ્યો છે, ત્યારે નવી લહેર જ્યારે આવશે ત્યારે વેક્સિન નહીં લાગી હોય તો આપણે તેની ઝપટમાં આવીશું. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ૬૩.૬૮ ટકા વેક્સિનેશન ગ્રામીણ વિસ્તારો અને ૩૬.૩૨ ટકા શહેરી વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. આમ છતાં દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો ખતરો વધ્યો છે. ૪ રાજ્યોમાં કોરોનાનું નવું રૂપ પહોંચી ગયું છે. દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ભલે ઘટી છે અને વેક્સિનેશનની ગતિ તેજ થઈ છે, પરંતુ આ તમામની વચ્ચે પ્લસ ડેલ્ટા વેરીઅન્ટે ચિંતા વધારી છે. અત્યારે દેશના મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં આ કેસ મળ્યા છે. કોરોના વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને વારંવાર મ્યુટેન્ટ થઈ રહ્યો છે. કોરોનાનું ભારતમાં જે ડેલ્ટા વેરિઅન્ટ મળ્યું હતું, આ ડેલ્ટા પ્લસ એ વેરિઅન્ટથી મ્યુટેન્ટ થઈને નીકળ્યો છે. ટેકનિકલ રીતે આને B.1.617.2.1 અથવા AY.1 નામ આપવામાં આવ્યું છે. આખા વિશ્વમાં હજી સુધી આ વેરિઅન્ટના ૨૦૦ કેસ મળી આવ્યા છે, જોકે તેમાંથી ૪૦ કેસ ભારતના છે. તેથી ભારતીય આરોગ્ય વિભાગ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર નજર રાખી રહ્યો છે. આ મામલે કેન્દ્રએ રાજ્યોને પગલાં લેવા પત્ર લખીને ચેતવણી આપી છે. હવે આ વેરીએન્ટ પર વેક્સિન અસર કરશે કે કેમ તેની તપાસ ICMR કરી રહ્યું છે. ડેલ્ટા વેરિઅન્ટ પહેલા ભારતમાં જે સ્થિતિ કોરોનાને કારણે સર્જાઈ હતી તે પણ અત્યંત ચિંતાજનક હતી. કોરોનાએ યુરોપના અનેક દેશોમાં તબાહી મચાવી છે. પરંતુ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ આ વર્ષે માર્ચમાં યુરોપમાં મળ્યો હતો, જે બાદમાં અન્ય દેશોમાં ફેલાયો છે. અત્યારે ICMR દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર વેક્સિન અસર કરશે કે નહીં કરે. આ માટે સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે અને ટેસ્ટિંગ ચાલી રહી છે.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach

✓ Bedbug

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator

RE/MAX REALTY SERVICES
INC., BROKERAGE
INDEPENDENTLY OWNED AND OPERATED

JAY PATEL
BROKER

647.241.3818
jaypatel1323@gmail.com

"Let Me Make Your Dream Home Into A Reality"

Residential, Commercial & Investment in Real Estate

Off : 905.456.1000 | Fax : 905.456.1924
295 Queen Street East, Brampton, On., L6W 3R1

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા ક્યોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$6.50 +Tax



CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise
Opportunity
in GTA

Call us for details

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine
Special
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



તક્ષશિલા અગ્નિકાંડના 13 આરોપી સામે ચાર્જશ્કેમની કાર્યવાહી પૂર્ણ થઈ

વધુ સુનાવણી તા.5 જુલાઈએ: 22 નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવે ગુમાવ્યા હતા

સુરત

સુરત તક્ષશિલા હોનારત કાંડમાં 14 પૈકી 13 આરોપીઓ વિરુદ્ધે લાંબા સમયથી પેન્ટિંગ ચાર્જશ્કેમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એડીશનલ સેશન્સ જજ ડી.પી.ગોહીલ એ આ કેસમાં સહ આરોપી સુરત મહાનગર પાલિકા ના આરોપી અધિકારી અતુલ ગોરસાવાલાની ડીસ્ચાર્જ અરજી હાઈકોર્ટમાં પેન્નડીંગ હોઈ તેમની સામે ચાર્જશ્કેમની કાર્યવાહી મોકકુફ રાખી છે. કોર્ટ આ કેસની વધુ કાર્યવાહી આગામી 5 જુલાઈ સુધી મુલતવી રાખી

છે. આજથી બે વર્ષ પહેલા સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડ બિલ્ડીંગ ના ગેરકાયદે ડોમમાં લાગેલી ભીષણ આગમાં 22 જેટલા વિદ્યાર્થીઓ નુ આગમાં ભુજાઈ જવાથી તથા બિલ્ડીંગ પરથી કૂદી પડવાથી મોત નિપજ્યું હતા. સુરત કાર્મ બ્રાચે તક્ષશિલા આર્કેડ બિલ્ડીંગના બિલ્ડર્સ દિનેશ વેકરીયા, જીગ્નેશ પાઘડાળ, હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર, સવજી ટપુ પાઘડાળ, નાટા ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ ભુટાણી, સુરત મ્યુનિ. ના અધિકારી પરાગ મુનશી, હીમાશુ

ગજજર, વિનુ પરમાર, જયેશ સોલંકી, અતુલ ગોરસાવાલા, ફાયર વિભાગના કીત મોડ, સંજય આચાર્ય તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી દિપક નાયક સહીત 14 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. કેસમાં સર્વોચ્ચ અદાલત સુધી કાનૂની લડતને પગલે ચાર્જશ્કેમની કાર્યવાહી પેન્ટિંગ રહી હતી. સરકારપક્ષે ખાસ સરકારી વકીલ પરમાર તથા ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓ તરફે પિયુષ માંગુકીયાએ પ્રપોઝ ચાર્જ કરવા માંગ કરી હતી.

તાપી નદીમાંથી એક સાથે ત્રણ મૃતદેહો બાંધેલી હાલતમાં મળ્યા

સુરત

કામરેજના આંબોલી ખાતે તાપી નદીમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. માછીમારી કરતા માછીમારે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોમાં એક 40 વર્ષીય સ્ત્રી તેમજ 15 વર્ષીય બાળક એકબીજાના હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બંને માતા પુત્ર હોવાનું પોલીસનું અનુમાન છે. જ્યારે અન્ય એક મૃતદેહ કઠોર તાપી કિનારેથી 4 થી 5 માસની બાળકીનો કોહવાયેલી

હાલતમાં મળી આવ્યો છે.

માછીમારોએ આજે તાપી નદીના પાણીમાં નાવડી લઈ મચ્છી પકડવાની જાળ નાંખી હતી. ત્યારે આંબોલી ગામની તાપી નદી કિનારે બે લાશ ટેપાતાં નજીક જઈ તપાસ કરતા આશરે 40 વર્ષીય મહિલા તેમજ 15 વર્ષીય બાળકની લાશ મળી આવી હતી. અત્યંત ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલી લાશમાં બન્ને લોકો વિપ્રૂટા નહીં પડે એ માટે મહિલાના જમણા હાથે તેમજ છોકરાના ડાબા હાથે દોરી બાંધેલી હાલતમાં સંભવિત મા-દીકરાની લાશ મળી આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રોપ-વે પ્રોજેક્ટ બે વર્ષમાં જ પૂર્ણ થઈ જશે

ગાંધીનગર : સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધારે ખૂબસુરત બનાવવા માટે રાજ્ય સરકાર વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળામાં 62 કરોડના ખર્ચે રોપ-વે બનાવી રહી છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રોપ-વે પાંચ સહાયક ટાવર સાથે એલિવેટેડ હશે અને તેની ઉંચાઈ બંધની ઉંચાઈથી વધુ હશે.

આ જગ્યાએ સફારી પાર્ક, કેકટ્સ ગાર્ડન, ફલાવર ઓફ વેલી, રિવર રાફ્ટીંગ, બટરફલાય પાર્ક, ટેન્ટસિટી, એમ્યુઝમેન્ટ પાર્ક, સી-પ્લેન સહિતના

પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ સરકારે કુલ 4000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીને આકર્ષવા માટે બે ગિરિમાળાને જોડતો વિશ્વકક્ષાનો રોપ-વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં યુરોપિયન ડિઝાઇન ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેકટ્સ ગાર્ડને જોડતો રોપ-વે બનશે જે 1.25 કિલોમીટર લાંબો હશે.

PNB કૌભાંડ: મુખ્ય સુત્રધાર નિરવ મોદીની સુરત સ્થિત 7 મિલકતો જપ્ત કરવા હુકમ

સુરત

પીએનબીના લોન કૌભાંડમાં સંડોવાયેલા ફરારી આરોપી નિરવ મોદીની સુરતના એસઈએડ ડાયમંડ યુનિટ મે.ફાયર સ્ટાર ડાટમંડ ઈન્ટરનેશનલ, રાધેશ્વર જ્વેલરીની કંપનીમાં રહેલા 10 કરોડથી વધુ કિંમતની ડાયમંડ જ્વેલરી સહીત સાત મિલકતો જપ્ત કરવા કસ્ટમ્સ સેન્ટ્રલ એક્સરસાઈઝ વિભાગે સુરત કોર્ટમાં અરજી કરી હતી. આજથી ત્રણેક વર્ષ પહેલા સુરત સીજીએમ કોર્ટમાં કસ્ટમ એક્ટના ભંગ



બદલ નિરવ મોદી સહિત અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ કોર્ટ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી નિરવ મોદીને એકથી વધુવાર કોર્ટના સમન્સ વોરંટ છતાં હાજર

થયા નહોતા. જેથી કસ્ટમ્સ વિભાગના અધિકારીએ સરકારી વકીલ ધર્મન્દ્ર પ્રજાપતિ મારફતે નિરવ મોદીની સુરતની સાત જેટલી સ્થાવર જંગમ મિલકતો જપ્ત કરવા માંગ કરી હતી. જે અંગે જાહેરનામું બહાર પાડવા છતાં નિરવ મોદી હાજર થયા નહોતા. જેથી સુરત સીજીએમ કોર્ટના જજ અમીતકુમાર દવેએ ફરિયાદી કસ્ટમ્સ સેન્ટ્રલ એક્સાઈઝની અરજીને મંજૂર કરી નિરવ મોદીની સુરતની સાત સ્થાવર જંગમ મિલકતો જપ્ત કરવા હુકમ કર્યો છે.

THANK YOU FRONTLINE WORKERS



MORTGAGE DILIGENT
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

5 Yrs Fixed @ 1.84%* High Ratio Only
5 Yrs Variable @ 1.15%* High Ratio Only
3 Yrs Variable @ 0.99%* (Special Promotion)



Rakesh Patel**
Vice President- Commercial.



Pranay Jani *



Nilesh Tailor *



Bala Shah*



Vijay Rana*



Rajesh Khurana, MBA
Principal Broker

Cell : 416-616-1300

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.* FSCO#10252,OAC,E&O.E * - Mortgage Agent, ** - Vice President

* Some conditions apply

ગુજરાતમાં પ્રવાસન સ્થળ વધશે ભૂજ ખાતે ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવન

ભૂજ

ભુજની ઓળખ સમા ભુજ્યા ડુંગરની તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્મૃતિવન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. સ્મૃતિવન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્રમોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કચ્છમાં આવેલા 2001ના ભૂકંપમાં મોતને ભેટેલા લોકોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવી રહ્યું છે. સ્મૃતિવન નિર્માણ થવાના કારણે કચ્છના પ્રવાસનના નકશામાં મહત્વનું એક સ્થળનો ઉમેરો થશે.

વર્ષ 2001માં કચ્છના વિનાશકારી ભૂકંપમાં મોટી ખુમારી થઈ હતી, જેમાં કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં મુન્યુ પામેલા લોકોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા ભુજ્યા ડુંગર તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્મૃતિવન બનાવવામાં આવી રહ્યું છે. અંદાજિત 155 કરોડ રૂપિયાના ખર્ચે સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે. પ્રવાસન સ્થળ તરીકે જાણીતા બનેલા કચ્છ જિલ્લામાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરો થવા થઈ

રહ્યો છે. ભુજની આન બાન અને શાન સમાન ભુજ્યા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન આકાર લઈ રહ્યો છે. સ્મૃતિવન પ્રોજેક્ટમાં સનસેટ પોઈન્ટ, 6 કિલોમીટરનો કમ્પાઉન્ડ હોલ તેમજ 50 જેટલા અલગ-અલગ આકારના ચેકડેમ, પાથવે, લાઈટીંગ, સોલાર કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં મ્યુઝીયમની કામગીરી ચાલી રહી છે.

કચ્છના ગોઝારા ભૂકંપમાં 13,000થી વધુ લોકોના મોત થયા હતા. ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા સ્મૃતિવન તૈયાર કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2014માં સ્મૃતિવન પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે 155 કરોડ રૂપિયા ફાળવામાં આવ્યા હતા. સ્મૃતિવન પ્રોજેક્ટનું કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે. પ્રોજેક્ટ સાથે લોકોની લાગણી જોડાયેલી છે. આથી પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

હળવદ ભાજપ મહામંત્રી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

હળવદ

સરકારી જમીન પર દબાણ મામલે હળવદ તાલુકા ભાજપ મહામંત્રી સંજય રૂપાભાઈ પંચાસરા વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવ્યો હતો. હળવદના શિરોઈ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીનના આઠ પ્લોટ પચાવી પાડી અંગત ઉપયોગ કરતા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે એક જ પરિવારના છ સભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. છ આરોપીને પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. શિરોઈ ગામે નવા ગામતળની સિંચાઈ વિભાગ હસ્તકની જમીનના પ્લોટ ઉપર શિરોઈ ગામના આરોપી કાળુ માવજી, વનરાવન રૂપા, પ્રતાપ માવજી, વિજય રૂપા, અનિલ અમરસિંહ અને સંજય રૂપાભાઈએ અંગત લાભ માટે ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો.

સીટ બેલ્ટ બન્યો મોતનું કારણ, કાર સાથે તથાતા રાજકોટના વૃદ્ધનું મોત

રાજકોટ

લોધીકાના રાવકી ગામની સીમમાં ન્યારી નદીના કોઝ-વે પરથી પસાર થઈ રહેલી કાર તથાઈ જતા તેમાં બેઠેલા રાજકોટના રાજનગર પાસે અનુપમા પાર્કમાં રહેતા બેન્ક ઓફ બરોડાના નિવૃત્ત કર્મચારી લાલજીભાઈ ચુકુભાઈ ઘેલાણી (ઉ.વ.૬૬) નું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્ની અને સંબંધી મહિલા પણ કાર સાથે તથાયા હતા. જો કે ગ્રામજનોએ બચેને બચાવી લીધા હતા.

રાજકોટ નજીકના રાજગઢ ગામના વતની લાલજીભાઈ વ્યવહારીક કામે ગઈકાલે પત્ની કુસુમબેન સાથે કોઠાપીપળીયા ગામે પોતાની ટીયાગો કાર લઈને ગયા હતા. જયાંથી પરત ફરતી વખતે તેમના સંબંધી હંસાબેન રાંકને રાજકોટ આવવું હોવાથી કારમાં બેસી ગયા હતા. આ વખતે વરસાદ ચાલુ હતો. રાવકી ગામે પહોંચતા ન્યારી નદી પરના કોઝ-વે પર પાણી હોવા છતાં પત્નીની સલાહને અવગણી કાર ત્યાંથી કાઢવા જતા પાણીમાં તથાઈ પલ્ટી ખાઈ નીચે ખાબકી હતી. જાણ થતા ગ્રામજનો



વૃદ્ધના પત્ની અને સંબંધીને ગ્રામજનોએ મહામહેનતે દોરડાની મદદથી બહાર કાઢી લીધા

દોડી આવ્યા હતા. મહામુસીબતે તેમણે કારના પાછળના કાચ તોડી કુસુમબેન અને હંસાબેનને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. પરંતુ સીટ બેલ્ટ નહી ખુલતા લાલજીભાઈ તત્કાળ બહાર નિકળી શક્યા ન હતા. ગ્રામજનો બચાવ કામગીરી કરતા હતા એટલામાં લાલજીભાઈની કાર ઉડા પાણીમાં ગરક થઈ ગઈ હતી. આમ છતાં ગ્રામજનોએ ખુબ જ મહેનત કરી દાંતરડાથી સીટ બેલ્ટ કાપી તેમને દોરડાની મદદથી બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત્યુ પામ્યા હતા.

ભાજપ સરકારથી નારાજ પુરપોતમ સોલંકી કેબિનેટમાં ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક

અમદાવાદ

વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારો માટે રાહત સહાય પેકેજ જાહેર કર્યું પણ હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી તે મુદ્દે ખુદ મંત્રી પુરપોતમ સોલંકીએ ભાજપ સરકાર સામે જ સવાલો ઉઠાવ્યા હતાં. એટલું જ નહીં, નારાજ મંત્રી પુરપોતમ સોલંકી કેબિનેટની બેઠકમાં ય ગેરહાજર રહ્યાં હતા જેના કારણે અનેક રાજકીય તર્કવિતર્ક વહેતા થયા છે. પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગ્યા બાદ ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની હતી. આ વાત માંડ શમી ત્યાં હવે ભાજપ સરકારના મંત્રી પુરપોતમ સોલંકી નારાજ થયા છે. તેમણે જ વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારોને સરકારે કંઈ આપ્યું નથી તેવું કહી ઉભરો ઠાલવ્યો હતો. ખુદ મંત્રીએ જ ભાજપ

સરકાર સામે સવાલો ઉઠાવતાં સરકારમાં આંતરિક ખેચતાણ અને રાજકીય ડબા હોવાની વાત ઉભરીને બહાર આવી છે. દરમિયાન, આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મળેલી કેબિનેટની બેઠકમાં નારાજ મંત્રી પુરપોતમ સોલંકી ગેરહાજર રહ્યાં હતાં. આ વાત રાજકીય ગલીયારીમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. આ નારાજગીના દોર વચ્ચે ગુરૂવારે ભાવનગરમાં કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે. પાટીદારો બાદ હવે કોળી સમાજ પણ રાજકીય અવગણના થઈ રહી હોવાના મુદ્દે રાજકીય શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. ભાવનગરમાં મળનારી બેઠકમાં રાજકીય નેતાઓ પણ હાજર રહેવાના છે ત્યારે મંત્રી પુરપોતમ સોલંકી હાજર રહેશે કે કેમ તેના પર ભાજપે નજર માંડી છે.

માછીમારોના મુદ્દે ભાજપ સરકારમાં રાજકીય ખટરાગ વધ્યો

રાજકોટમાં નશામાં ધૂત પતિએ સમાગમ વખતે પત્નીના ગુપ્તાંગ પર બચકા ભર્યા

રાજકોટ

રાજકોટમાં નશામાં યૂર પતિએ પત્ની સાથે વિકૃત સેક્સલીલા આચરી હતી. જેમાં પાશવી ત્રાસથી પત્નીએ ફિનાઈલ પી લીધું હતું. પરંતુ સદનસીબે મહિલાને હોસ્પિટલમાં ખસેડી બચાવી લેવામાં આવી છે. નશામાં યૂર પતિએ તારી સાથે હવે મજા નથી આવતી, હાડકા લાગે છે કહીને ગુપ્તાંગમાં બચકા ભર્યા હતા.

રાજકોટની ભાગોળે રહેતી પરિણીતાને તેના પતિએ દારૂ ઢીચી, મારકૂટ કરી ત્રાસ ગુજારતા તેણીએ ફિનાઈલ પી લેતા હોસ્પિટલે ખસેડાઈ છે

પતિએ ગુપ્તાંગમાં બચકા ભર્યાનો આક્ષેપ કરતા તાલુકા પોલીસે અટકાયતી પગલા લીધા છે. શહેરના ભીમનગરમાં રહેતા રીટાબેન રવિભાઈ વાઘેલા ઉ.30 નામની પરિણીતાએ ફિનાઈલ પી લેતા તેણીને હોસ્પિટલે ખસેડાઈ હતી પ્રાથમિક તપાસમાં તેણીના આ ત્રીજા લગ્ન હોવાનું જાણવા મળ્યું હતું તેણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પતિ રવીએ પંદર દિવસ પૂર્વે ચિકકાર દારૂનો નશો કરી શરીરસુખ માણ્યું હતું અને ગુપ્તાંગમાં બચકા ભર્યા હતા. જેથી તેણીને પીડા થતા ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું છતાં લઈ ગયો ન હતો.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 : Our disinfectant services that we offer are:

1 Spray Services

2 Fogging Services

3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets

First Time Customer gets

10% Off

on your first home service

*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820



મહેસાણા દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશા ઠાકોરના 6 દિવસના રિમાન્ડ મંજૂર

ઘીમાં ભેળસેળ કરવાના ગુનામાં ધરપકડ કરાઈ, પોલીસે સેશન્સ કોર્ટમાં કરી કાર્યવાહી

મહેસાણા

મહેસાણાની દુધસાગર ડેરીના રાજસ્થાન પુનઢાના પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવતા ઘીમાં ભેળસેળ થતી હોવાનું સામે આવતાં મહેસાણા બી ડિવીઝન પોલીસ મથકે ડેરીના તત્કાલીન ચેરમેન આશા ઠાકોર, પૂર્વ વાઈસ ચેરમેન મૌઘજી દેસાઈ, એમડી નિશીત બક્ષી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં પૂર્વ મહિલા ચેરમેનને બે દિવસ અગાઉ

તેમના ફાર્મ હાઉસમાંથી ઝડપી લેવાયા હતા. તેઓના કોવિડ ટેસ્ટ કરાવી આખરે ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે અધિકારી એ.બી.વાળંદ દ્વારા આરોપી આશા ઠાકોરને મહેસાણા ખાતે એસીબી સેશન્સ કોર્ટના જજ એમ.ડી.પાંડેયની સમક્ષ રજૂ કરીને ૧૦ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં સ્પે.સરકારી વકીલ વિજય બારોટની દલીલોના આધારે અદાલતે આરોપીના ૨૮ જુન સુધીના ૬

દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શુધ્ધ ઘીમાં ભેળસેળના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ દુધ સાગર ડેરીના તત્કાલીન ચેરમેન આશા ઠાકોરને કોર્ટમાં રજૂ કરાતા સ્પે.સરકારી વકીલ વિજય બારોટ દ્વારા રિમાન્ડ માટે ૧૫ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી તપાસમાં સહકારી આપતા ન હોવાથી રિમાન્ડ મળવાથી સત્ય હકિકત બહાર આવે તેમ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

MLA ગેનીબેન ઠાકોર સામેની રદ FIRની ફરી સુનાવણી કરવા અરજી

અમદાવાદ

બનાસકાંઠાના ભાભર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલના સ્યુસાઈડ કેસમાં વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ હતી. હાઈકોર્ટે ૨૦૨૦માં આ ફરિયાદ રદ કરતા મૃતકના પત્નીએ હાઈકોર્ટમાં રિટ કરી હતી કે તેઓ આ ઘટનાના અસરગ્રસ્ત છે અને તેમનો પક્ષ સાંભળવો જોઈએ અને ફરિયાદ રદ કરવાની અરજીની ફરી સુનાવણી થવી જોઈએ. હાઈકોર્ટે તમામ પ્રતિવાદીઓને નોટિસ પાઠવી વધુ સુનાવણી નવમી જુલાઈનો રોજ નિયત કરી છે. આ કેસની વિગત એવી છે કે

ઓગસ્ટ-૨૦૧૬માં ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. તેમણે લખેલી ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટમાં આક્ષેપ કરાયો હતો કે સ્થાનિક બુટલેગરો, રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓ તેમને ત્રાસ આપે છે અને ડરાવે-ધમકાવે છે. આ કેસમાં ગેનીબેન સહિત આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ વ્યક્તિઓએ પોલીસ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને રજૂઆત કરી હતી કે મૃતકના ભાઈ ફરિયાદી છે અને તેમની સાથે સમાધાન થયું છે.

ઉત્તર ગુજરાતના ખ્યાતનામ ગાયક વિજય સુંવાળા આપમાં જોડાયા

મહેસાણા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં આવતા જ તમામ પક્ષો સક્રિય થયા છે. ખ્યાતનામ હસ્તીઓ આપમાં જોડાતા આપ પણ હવે એક મજબૂત પક્ષ તરીકે ઉભરી રહ્યું છે. આપ સાથે વધારે બે ખ્યાતનામ હસ્તીઓ જોડાઈ છે. મહિપતસિંહ ચૌહાણ અને વિજય સુંવાળા બંને આપમાં જોડાયા હતા. ઉત્તરગુજરાતનાં ખ્યાતનામ કલાકારોમાં વિજય સુંવાળાની ગણતરી થાય છે. વિજય સુંવાળા ઉત્તર ગુજરાતમાં મજબૂત ફેન ફોલોઈંગ ધરાવે છે. આપમાં જોડાયા બાદ મહિપતસિંહે જણાવ્યું કે, મારી વિચારધારા અને વિઝનમાં જે પાર્ટી ફીટ થાય છે તે આમ આદમી પાર્ટી છે. 2025 પહેલા ગુજરાતના 500 દર્શ ગામ આપવા માટે સ્વપ્ન છે.

નડિયાદ પાસે અકસ્માતમાં 3ના મોત, મહિલાનું માથુ ઘડથી અલગ થઈ ગયું

નડિયાદ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. રોડ સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ઈકો કાર ઘૂસી જતાં હાઈવે પર કમકાટીભર્યા દ્રશ્યો સામે આવ્યા છે. નડિયાદ પાસે બનેલી આ ઘટનાએ થોડા દિવસ પહેલાં આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, એક મહિલાનું માથુ ફાટી ગયું હતું.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે



પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને 7 લોકો ઘાયલ થયા છે. અમદાવાદથી વડોદરા તરફ જતા એક્સપ્રેસ હાઈવે પર રોડ પર સાઈડ ઉભી રહેલ ટ્રકની પાછળ ઈકો કાર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો.

સેવાલિના દેવ ઘોડા મંદિરના મહંત બ્રહ્મલીન થતાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ગળતેશ્વર

ખેડા જિલ્લાના સેવાલિના દેવઘોડા મંદિરના મહંતશ્રી બ્રહ્મલીન થતાં શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી વ્યાપી છે. મહંતશ્રીના અંતિમદર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગળતેશ્વરના તાલુકામથક સેવાલિયા પાસે મહી નદિના કિનારે પૌરાણિક દેવઘોડા મંદિર આવેલું છે, જે લાખો શ્રદ્ધાળુઓનું માનીતું તીર્થસ્થળ છે. મંદિરના ૭૦ વર્ષના પૂ. મહંતશ્રી શંકરગીરી મહારાજ છેલ્લાં વીસ વરસથી મંદિરમાં સેવા આપી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મંગળવારે રાતે ૧૨ વાગ્યાની આસપાસ તેઓ બ્રહ્મલીન થયા હતા. આ સમાચાર ફેલાતા જ શ્રદ્ધાળુઓ દેવઘોડા મંદિરમાં મહંતશ્રીના અંતિમ દર્શન માટે ધસી આવ્યા હતા.

અંબાજીમાં હવે યાત્રિકો સાથે ઉઘાડી લૂંટ નહિ ચલાવાય : તંત્ર હરકતમાં

પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ, તોલમાપ, પંચાયત વિભાગોને નિર્દેશ આપ્યા

અંબાજી

અંબાજીમાં વર્ષ દહાડે લાખો માઈભક્તો માના ચરણોમા શિશ નમાવે છે. પરંતુ અનેક માઈભક્તોને યાત્રાધામમાં કડવા અનુભવ થાય છે અને અંબાજીની પ્રતિષ્ઠા ખરડાય છે. પ્રસાદમાં ઉઘાડી લૂંટ અને પાકગમાં દાદાગીરીથી લઈ ગુણવત્તા વિહીન વસ્તુઓ વેચાતી હોવાની બુમરાડને આધારે કલેક્ટરે યાત્રિકોની સુરક્ષાની વ્યવસ્થા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મિટિંગ યોજી હતી. જેમાં યાત્રિકો સાથે છેતરપીંડી અને દાદાગીરી કરનાર સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

માઈભક્તો સાથે અંબાજીમાં પ્રસાદીયા ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની બુમરાણ ઉઠી છે ત્યારે

આવનાર યાત્રિકોને પાકગને લઈને પણ દાદાગીરી સહન કરવી પડે છે. યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોની સુરક્ષા જળવાય તે હેતુથી બનાસકાંઠા કલેક્ટરે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. કલેક્ટર દ્વારા પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ, તોલમાપ, રેવન્યુ, પંચાયત અને ગ્રાહક સુરક્ષા સહિતની ટિમોની રચના કરી કાર્યવાહીના આદેશ આપ્યા છે તેમજ પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે. અંબાજીમાં આવનાર યાત્રિકો સાથે પ્રસાદમાં લૂંટ ન થાય એ હેતુથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના ૩ કેન્દ્રો ખોલશે સાથે યાત્રિકોની સુરક્ષા જળવાય એ હેતુથી અંબાજીમાં જાહેર માર્ગ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કાયમી ધોરણે ખોલાશે.

આણંદના વીરસદમાં કાકા દ્વારા ભત્રીજાની હત્યા થતાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો

આણંદ

આણંદના બોરસદ તાલુકાના વીરસદ ગામમાં આવેલ ખોડીયારપુરા સીમ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ઉર્ફે જગદીશભાઈ નાનજીભાઈ ઠાકોર (ઉ. વ. ૨૫)ની બહેન સુમિત્રાના લગ્ન હોઈ પરિવાર પ્રસંગની તૈયારીઓમાં હરખથી જોડાયો હતો. તે દરમિયાન ગત શનિવારે રાત્રીના સુમારે ઘરના શુભ પ્રસંગને લઈ રસોઈ બનાવવા માટે રસોડું ઉભું કરવા ઘરની બહાર ચુલો બનાવવા માટે અરવિંદભાઈ અને કાકા પુનમ ઠાકોર (અંદાજિત ઉંમર ૪૦) તથા અન્ય માણસો ઘરની બહાર ખાડો ખોદવા માટે ઉભા હતા. દરમિયાન અરવિંદભાઈ અને કાકા પુનમભાઈ વચ્ચે ચુલાનો ખાડો ખોદવા

બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. કાકા ભત્રીજા વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલીએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજાને પેઢામાં લાત મારી દેતાં ભત્રીજો અરવિંદ જમીન પર ફસડાઈ પડ્યો હતો. જ્યાં જમીન ઉપર મુકેલું તપેલું અરવિંદને માથામાં પાછળના ભાગે વાગતાં ત્યાં જ બેભાન થઈ ગયો હતો. અચાનક બનેલ આ ઘટનાથી બુમાબુમ થતાં ઘરના સભ્યો અને મહેમાનો દોડી આવ્યા હતા. ઘવાયેલ અરવિંદને તાત્કાલિક સારવાર માટે ધર્મજની હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા જતાં રસ્તામાં અરવિંદે દમ તોડી દીધો હતો.



First Flight
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

1 LB \$20 વધુ દર LB ના \$6	ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)
11 LB \$55 વધુ દર LB ના \$6	
23 KG \$185, વધુ દર KG ના \$10	
30 KG \$230, વધુ દર KG ના \$10	

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

Brampton (West)	Scarborough	Mississauga
519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, Opposite Vegetables Market. Phone 647-761-1317, 647-657-9631 -----: MON-THU : ----- 2.00 PM to 6.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 1.00 PM to 6.00 PM	WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-TUE : ----- 2.00 PM to 6.00 PM : SAT-SUN : 11.00 AM to 6.00 PM	2960 Drew Road, Unit-158, Mississauga ON L4T 045 Great Punjab Plaza, Next to Malton Gurudwara. : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 5.00 PM

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com



બોલીવૂડમાં લાંબા સમય બાદ પાછી ફરશે મીનાક્ષી

૮૦-૯૦ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાંની એક મીનાક્ષી શેષાદ્રી હવે બોલીવૂડમાં પાછી ફરી રહી છે. ફિલ્મમેકર્સ સાથે તે ફિલ્મોમાંના રોલ માટે વાતચીત કરી રહી છે. મીનાક્ષી શેષાદ્રીએ એક ઇન્ટરવ્યુમાં તાજેતરમાં જણાવ્યું હતું કે, તે ફરીથી એક્ટિંગની દુનિયામાં કમબેક કરવા માંગે છે. એટલું જ નહીં આ માટે તે ફિલ્મમેકર્સ સાથે વાતચીત પણ કરી રહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે એક એવી સ્ક્રિપ્ટ અને રોલની શોધમાં છે જેના દ્વારા તે ફરી દર્શકોના દિલમાં એક્ટિંગ દ્વારા સ્થાન જમાવી શકે.



મા કે બહેનના પાત્રો નથી કરવા કરિશ્માને

અભિનય ક્ષેત્રે સોળ વર્ષથી કાર્યરત ખુબ જ સુંદર એવી અભિનેત્રી કરિશ્મા તન્ના ફિલ્મો અને ટીવી એમ બંને ક્ષેત્રોમાં સફળ રહી છે. કરિશ્માએ વર્ષ ૨૦૦૫માં ફિલ્મ દોસ્તી-કેન્ડુસ ફોર એવરથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી પાંચ જેટલી ફિલ્મો કરી છે. પરંતુ તેને ઓળખ ટીવી પરદેથી પ્રાપ્ત થઈ છે. ૨૦૦૧માં કયું ક્રી સાસ ભી કભી બહુ થી શોમાં તે સતત છ વર્ષ સુધી જોડાયેલી રહી હતી. ત્યારબાદ સતત તેણે ટીવ શો, રિયાલીટી શો, કાઈમ શોમાં કામ કરીને પોતાને સક્રિય રાખી છે. હાલમાં વેબસિરીઝનું ચલણ છે. ત્યારે કરિશ્મા પણ ઈચ્છે છે કે તે વેબ સિરીઝ કરે. કરિશ્મા મા કે બહેનનું પાત્ર ભજવવા નથી માગતી અને તેની ઈચ્છા છે કે તે એવી જ વેબસિરીઝ કરે જેનું સેન્ટર કેરેક્ટર તે પોતે હોય. કરિશ્માને એકતા કપૂરથી લઈને અપલોઝ એન્ટરટેઈનમેન્ટ જેવા મોટા સ્ટુડિયોમાંથી ઓફર આવી હતી. પરંતુ તેણે સાત જેટલી સિરિયલની ઓફર નકારી કાઢી હતી.

નિષ્ફળતામાં હિમ્મત હારવી નહિ : કિતી સેનોન

બોલીવૂડમાં હીરોપંતી ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર કિતીએ હવે અહિ ઓળખ ઉભી કરી લેતાં સતત મોટા બેનરની અને મોટા સ્ટાર સાથેની ફિલ્મો તેને મળી રહી છે. હાલમાં તે સોથી વધુ ઉત્સાહિત પોતાની ફિલ્મ આદિપુરુષને કારણે છે. કારણ કે આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. રામાયણ પરથી બનેલી આ ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ રામના રોલમાં છે. તો સૈફ અલી ખાન રાવણ બન્યો છે. સિતાનો રોલ કિતી નિભાવી રહી છે. ઓમ રાઉત નિર્દેશીત આ ફિલ્મ વિશે કિતીએ કહ્યું હતું કે આ ફિલ્મની હું આતુરતા પુર્યક રાહ જાઉં છું. આ ફિલ્મમાં કામ કરવાનો મારો અનુભવ તદ્દન અલગ રહેશે. સફળતા અને નિષ્ફળતા વિશે કિતીએ કહ્યું હતું કે હું એક મંત્રને ધ્યાને રાખીને આગળ વધું છું કે સફળતામાં તમારે છકી જવું જાણ્યું નહિ, એટલે કે તમારા મગજમાં એ ભરાય જવી ન જાણ્યું અને નિષ્ફળતા મળે તો તેમાં ક્યારેય હિમ્મત હારવી જાણ્યું નહિ. કિતીની અન્ય ફિલ્મોમાં ભેડીયા, બચ્ચન પાંડે, ૧૪ ફેરે સામેલ છે.



આલિયા ભટ્ટે બોલ્ડ કેલેન્ડર શૂટ કરાવ્યું

બોલીવૂડની ઘણી એક્ટ્રેસ તાજેતરમાં પોતાના બોલ્ડ અવતારને ઇન્ટરનેટ પર ફ્લોન્ટ કરીને તેમના ફેન્સને કાચલ કરી રહી છે. આલિયા ભટ્ટ પણ આમ કરવામાં પાછળ નથી. આલિયાએ પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપતા તેનો બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આલિયાના આ ફોટોમાં તે સિગ્નલિંગ અંદાજમાં જોવા મળે છે. ઇન્ટરનેટ પર હાલમાં તેની તસવીર ખૂબ જ વાયરલ થઈ છે. બ્લૂ કલરના ગાઉનમાં આલિયા બ્યુટિકૂલ દેખાય છે. આલિયાનો આ અંદાજ તેના ફેન્સને ઘણો ગમ્યો છે.



આદિપુરુષ ફિલ્મમાં કિતી સેનોન સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે મુખ્ય ભુમિકામાં નજરે પડશે

PayLessTravel
Fly Well ... Pay Less

વિમાની સેવાના બુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ

Call for all your Air Travel Services

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

Call us for the Lowest Fares Coming From India to Canada Also

Please Call 905-281-2627

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time

Tico # 50015262
tico.ca
Travel Industry Council of Ontario

GRAND CENTRAL MIMICO
(South Tower)

Guaranteed Access to this prestigious project.

Located at Royal York Rd & Evans Ave in Etobicoke! Grand Central Mimico will feature direct access to the Mimico GO Station,

Starting from **\$500's**

Nadir Shah MBA
Sales Representative

416.625.3580
nadir.shah@sympatico.ca

CENTURY 21
Regal Realty Inc. Brokerage
Member Broker

4030, Sheppard Ave. East, Toronto, ON M1S 1S6 T: 416.291.0929 (24/7)
F: 416.291.0984

Not Intended to solicit buyers or sellers already under a contract



॥ સંસ્કૃતિ ॥

હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!
રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



ન્યૂઝિલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય બેસ્ટમેનો બે દિવસ પણ ટકી ના શક્યા

ટીમ ઈન્ડિયાને શિક્ષત : આબરું પણ ન બચી

ઈંગ્લેન્ડના રોજ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી ભારત સામેની ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડે આસાનીથી જીતી લીધી. મેચના અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડે ૨ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારતે બીજી ઈનિંગ્સમાં ૧૭૦ રન બનાવ્યા અને ૧૩૮ રનની લીડ હાંસલ કરી. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ ૧૩૮ રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી હતી અને ૨ વિકેટ ગુમાવીને ૧૪૦ રન બનાવીને મેચ જીતી લીધી હતી. 'ટીમ ઈન્ડિયા'નું ઘોડું ફરી એક વાર દશરના દાડે જ ના દોડ્યું અને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યૂ ઝિલેન્ડ સામે ભૂંડી રીતે હારીને ભારતે ઈતિહાસ રચવાની તક ફરી વેડફી કાઢી. ન્યૂઝિલેન્ડ સામે ભારત વધારે મજબૂત છે એવું સૌ માનતા હતા. તેથી ટેસ્ટ ચેમ્પિયનશીપની પહેલી ફાઈનલ જીતીને ભારતીય ટીમ ઈતિહાસ રચી નાંખશે તેવું સૌ કોઈ માનતું હતું. પરંતુ ઈતિહાસ રચવાની વાત તો દૂર રહી પણ ભારતીય ટીમ આબરૂ પણ ના બચાવી શકી. સૌથી વધારે શરમજનક વાત તો એ કહેવાય કે, આ ફાઈનલ પૂરા પાંચ દિવસ પણ ચાલી નહીં. ભારતીય ટીમના ધુરંધર મનાતા બેટ્સમેન બંને ઈનિંગ્સમાં મળીને ૧૬૫ ઓવર્સ રમ્યા. ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં ૮૦ ઓવર નખાતી હોય છે એ જોતાં ભારતીય બેટ્સમેન બે દિવસ પણ ના ટકી શક્યા. બીજી ઈનિંગ્સમાં તો ભારતીય ટીમના ખેલાડીઓની એક પછી એક વિકેટો પડતી ગઈ અને ભારતીય બેટ્સમેન કોઈ ઈન્ટરનેશનલ મેચને બદલે સ્કૂલનાં શિખાઉ છોકરાંની મેચ રમતા હોય એ રીતે રમ્યા.

૨૦૨૧ની ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની હાર ન્યૂ ઝિલેન્ડ સામે ત્રણ વર્ષ પહેલાં વર્લ્ડકપમાં થયેલી ભૂંડી હારનું પુનરાવર્તન છે. ૨૦૧૯માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપમાં ન્યૂ ઝિલેન્ડે ત્રણ વર્ષ પહેલાં આ રીતે જ ભારતને મોટો આંચકો આપીને ભારતી ઈજ્જતનો કચરો કરી નાંખ્યો હતો. ઈંગ્લેન્ડમાં ૨૦૧૯ના ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતે ગુપ સ્ટેજમાં ટોપ પર રહ્યા પછી ન્યૂ ઝિલેન્ડ સામે સેમી ફાઈનલ રમવાની આવી હતી. બીજી સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટક્કર હતી. તેમની સરખામણીમાં ન્યૂ ઝિલેન્ડની ટીમ નબળી મનાય છે તેથી ભારતને એવું જ લાગતું હતું કે, ન્યૂ ઝિલેન્ડની ટીમને તો આસાનીથી પછાડી દઈશું. ભારતના ક્રિકેટના ચાહકો પણ આ જ સપના જોતા હતા. આ સમયે ભારતના બોલરોએ સેમી ફાઈનલ મેચમાં જોરદાર બોલિંગ કરીને ન્યૂ ઝિલેન્ડની ટીમને ૨૩૮ રન જ કરવા દીધા હતા. વળી, સ્કોર બહુ મોટો ન હતો તેથી તે તો રમતાં



રમતાં કરી દેવાશે એવું બધા માનવા માંડ્યા હતા. પરંતુ ન્યૂ ઝિલેન્ડની ટીમે અકલ્પનિય લડત આપીને ભારતી ઈજ્જતનો ધજાગરો કરી નાંખીને ભારતને વર્લ્ડકપની બહાર ફેંકી દીધા હતા.

આ વખતે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ ભારતીય ટીમે આ રીતે જ વરઘોડો કાઢ્યો છે. વરસાદે વિદ્ય નાખ્યું પછી ટોસ હાર્યા તેમાં પહેલી ઈનિંગ્સમાં ૨૧૭ રનમાં ભારતનું પડીકું થયું એ હજુ માફ કરી શકાય. વરસાદ પડવાથી પિચ ભીની હોય, એટલે રમવાનું કપરું હતું.

તેમાં ભારતના બેટ્સમેન ના ચાલ્યા, એ સમજી શકાય. પરંતુ ભારતના બોલરોએ જોરદાર બોલિંગ નાખીને ન્યૂ ઝિલેન્ડને ૨૪૮ રનમાં ઓલઆઉટ કરી દીધું પછી ભારતીય ટીમ પાસે જીતવાનો નહીં તો આબરૂ બચાવીને મેચને ડ્રોમાં ખેંચવાનો

**પ્રાસંગિક
ધવલ શુક્લ**

કોહલી અને પૂજારાએ કરેલો ધબકો ટીમ ઈન્ડિયાની હારનું મહત્વું કારણ : સપાટ પીચ પર રનના ખડકલા કરતા ભારતીય બેસ્ટમેનો ભીની પીચ પર સફળ થતા નથી તે વાત ફરી પૂરવાર થઈ

મોકો હતો જ. ન્યૂ ઝિલેન્ડની લીડ ૩૨ રનની હતી અને આ લીડ કંઈ ના કહેવાય. ભારતે એક દિવસ જ ખેંચવાનો હતો. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન એક દાડો પણ ના ખેંચી શક્યા. બીજી ઈનિંગ્સમાં ૭૩ ઓવરમાં ૧૭૦ રનમાં ભારતીય ટીમ તંબુ ભેગી થઈ ગઈ. તેથી ન્યૂ ઝિલેન્ડે જીતવા માટે ૫૩ ઓવરમાં ૧૩૮ રન કરવાના હતા.

એક ઓવરે ૩ રનથી પણ ઓછા રન કરવાના હોવાથી મેચ ન્યૂઝીલેન્ડના પક્ષે જ હતી. આમ છતાં ભારતના બોલરોએ હતાશ થયા વિના જીવ રેડીને બોલિંગ કરી તો કોહલી આણિ મંડળીએ કેચ છોડીને તેમના કર્યા કરાવ્યા પર પાણી ફેરવી દીધું.

ન્યૂ ઝિલેન્ડ સામેની હારે ભારતી જૂની અને જાણીતી નબળાઈને ફરી છતી કરી દીધી છે. ભારતના ધુરંધર ગણાતા બેટ્સમેન ભારતની સપાટ પિચો પર રનના ઢગલા ખડકે છે. પણ જરાક બોલ મૂવ થવા માંડે કે તેમના ટાંટિયા ધૂજવા માંડે છે. આ વખતે વિરાટ કોહલીની ટીમે આ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હારીને છ મહિનામાં જ ટેસ્ટ મેચમાં બીજી વાર ભારતીયોને નિરાશ કર્યા છે. ભારતની ક્રિકેટ ટીમ ૨૦૨૦ના ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ ત્યારે

પહેલી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં માત્ર ૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં બીજા દિવસ સુધી ભારતીય ટીમ છવાયેલી હતી. ત્યારે પણ વિરાટ કોહલીની ટીમે બીજી ઈનિંગ્સમાં માત્ર ૩૬ રનમાં ઓલઆઉટ થઈને એ ઉત્સાહ પર પાણી ફેરવી દીધું હતું. સદનસીબે વિરાટ કોહલી પિતા બનવાનો હોવાના

કારણે ભારત પાછો ફર્યો અને અર્કિજય રહાણેના હાથમાં ટીમની કમાન આવી પછી ટીમે જોરદાર દેખાવ કરીને ઓસ્ટ્રેલિયાને બાકી રહેલી ત્રણ ટેસ્ટમાંથી બે ટેસ્ટમાં રગદોળીને સિરીઝ જીતીને રંગ રાખેલો. કમનસીબે એ વખતે ત્રણ ટેસ્ટ બાકી હતી તેથી ભારતને સિરીઝમાં પાછા ફરવાની તક મળી હતી. જો કે, ૨૦૨૧માં ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં તો એ તક પણ નથી રહી, તેથી આ હાર આઘાતજનક છે જ.

આ ટેસ્ટે વિરાટ કોહલીની કેપ્ટન્સી સામે પણ ફરી સવાલ કરી દીધો છે. કોહલી કાવાદાવા કરીને કેપ્ટન તો બની ગયો પણ તેનામાં સૌરવ ગાંગુલી કે મહેન્દ્રસિંહ ધોનીની જેમ કપરા કાળમાં દોરવાની ક્ષમતા નથી. આ વાત અનેક વાર સાબિત થઈ છે અને આ ટેસ્ટમાં ફરી સાબિત થઈ. ભારતે ગાંગુલી કે ધોનીની વાત ના કરીએ પણ કોહલી ન્યૂ ઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન સામે પણ સાવ વામણો સાબિત થયો. વિલિયમસન પહેલી ઈનિંગ્સમાં વિકેટો પડતી હતી ત્યારે એક છેડો સાચવીને અડીખમ ઊભો રહ્યો. તેમાં ન્યૂ ઝિલેન્ડની ટીમને સરસાઈ મળી હતી. બીજી ઈનિંગ્સમાં તો વિલિયમસને ટીમને જીત તરફ દોરીને જ રાહતનો શ્રવાસ લીધો. કોહલીની બેટ્સમેન તરીકેની મર્યાદા પણ આ મેચમાં છતી થઈ. કોહલી બંને ઈનિંગ્સમાં એક સરખી રીતે આઉટ થયો. ન્યૂ ઝિલેન્ડના બોલરોએ કોહલીની નબળાઈ પર ઘા કરીને તેને ફસાવ્યો. કોહલી સતત આ પ્રકારના બોલમાં જ આઉટ થાય છે અને પોતાની નબળાઈ પર જીત મેળવી શકતો નથી, તેની કિંમત આખી ભારતીય ટીમે ચુકવી છે.

હાલ ટેસ્ટ સીરીઝમાં પછાડાટ બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારતની હારનું કારણ આપતા કહ્યું છે કે, પાંચમા દિવસની રમતની શરૂઆતની દસ જ મિનિટમાં ભારતે પહેલા કોહલી અને પછી પૂજારાની વિકેટ ગુમાવી હતી અને આ જ ભારતની હારનું કારણ હતું. તેંડુલકરે ન્યૂઝીલેન્ડને વિશ્વ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ વધારે સારી ટીમ હતી અને ટીમ ઈન્ડિયા પોતાના દેખાવથી ચોક્કસ નિરાશ હશે. બીજી તરફ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન લક્ષ્મણે પણ કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી અને બીજી ઈનિંગમાં વિલિયમસન અને ટેલરે પોતાનો અનુભવ કામે લગાડીને બેટિંગ કરી ટાર્ગેટ હાંસલ કર્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને જીત બાદ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય ટીમની પ્રશંસા કરી હતી.

રોજ પીઓ આ બે શાકના જ્યુસ, તમારી ત્વચામાં આવી જશે ચમક



ચહેરાની સુંદરતા જાળવવા માટે છોકરીઓ મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ દૈનિક આહારમાં કેટલીક તંદુરસ્ત ચીજોનો સમાવેશ કરવાથી ત્વચાને ઉડે સુધી પોષણ મળે છે. તે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરીને ચહેરા પર ગ્લો મેળવવા માટે મદદ કરે છે. ચાલો આજે અમે તમને એવા જ્યુસ વિષે જણાવીએ છીએ, જે સ્વાદિષ્ટ હોવાની સાથે તમારી ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આ રીતે, તમે ચહેરા પર પડેલા ડાઘ, કરચલીઓ, પિમ્પલ્સ વગેરે જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

બીટનો રસ

ચહેરા પર કુદરતી અને ગુલાબી ગ્લો લાવવા માટે, તમે દૈનિક આહારમાં બીટનો રસ શામેલ કરી શકો છો. તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ ગુણ ચક્રવર્તી સાફ કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં શરીરમાં હાજર ગંદકી બહાર આવે છે અને ચહેરો ખૂબ જ સાફ અને સુંદર લાગે છે.

આ રીતે બનાવો

બીટનો છાલ નીકાળી લો અને કાપી લો. ત્યારબાદ તેના જ્યુસને મિક્સરમાં બનાવો. એક ગ્લાસમાં તૈયાર જ્યુસ ભરો અને કાળા મીઠા અને લીંબુનો રસ અને મીઠું મિક્સ કરીને પીઓ.

ગાજરનો રસ

ગાજરમાં રહેલા પોષક તત્ત્વો અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણધર્મો ત્વચાને ઉડે સુધી પોષણ આપે છે. તે લોહીને શુદ્ધ કરીને ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. ગાજરમાં હાજર વિટામિન એ પિમ્પલ્સ અને કરચલીઓથી બચાવે છે. આ સિવાય તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોવાને કારણે પેટ સાફ રહે છે અને પાચક શક્તિ મજબૂત બનાવે છે.

આ રીતે બનાવો

આ માટે, ગાજરની છાલ નીકાળી લો અને કાપી નાખો. તેનો રસ કાઢવા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અને સંચળ ઉમેરી લો પછી તેનું સેવન કરો.

જોકર માલવેર શું છે?

જોકર માલવેર એ એક ફિશિંગનો પ્રકાર છે. જે વેબ પેજ પર જાહેરાતના રૂપ માં હોય છે. જેના પર ક્લિક કરવાથી કોમ્પ્યુટર બ્રાઉઝરમાં નવું વેબ પેજ ઓપન કરે છે અને મોબાઇલમાં પ્લેસ્ટોર પર જઈને એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાનું કહે છે. ત્યારબાદ જેને વેબ પેજ અથવા એપ્લિકેશનમાં ફોર્સફૂલી લોગઈન અથવા સાર્ઈન-અપ કરવા કહે છે. લોગઈન થયા બાદ જોકર માલવેર એક્ટીવ થઈને કોમ્પ્યુટર અથવા મોબાઇલ પર પોતાની હુકમત બનાવે છે. મોબાઇલની સિક્યુરીટીને બાયપાસ કરી મોબાઇલમાં SMS વાંચી શકે છે. મોટે ભાગે આ માલવેર પૈસાની ચોરી કરવા માટે હેકર દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે મોબાઇલમાં એપ્લિકેશનના રૂપમાં કમાન્ડ-એન્ડ-કન્ટ્રોલ (C&C) તરીકે રહે છે અને વારંવાર પોતાને અપડેટ કરે છે. જેથી યુઝર દ્વારા કરવામાં આવતી નાનામાં નાની એક્ટીવીટીની માહિતી હેકર સુધી પહોંચી શકે. મોટેભાગે જોકર માલવેર બેન્કિંગને લગતી એપ્લિકેશન પર ચાંપતી નજર રાખે છે. ગુગલ પ્લેસ્ટોર પર ગત અઠવાડિયે આ માલવેર



8 એપ્લિકેશનમાં જોવા મળ્યો હતો. જે યુઝર્સના મોબાઇલમાં આ એપ્લિકેશન ઈન્સ્ટોલ હોય તે યુઝર્સની કોલ ડીટેઈલ્સ, SMS અને અન્ય બેન્કિંગ એપ્લિકેશનની નોટિફિકેશન જોઈ શકે છે અને આ માહિતી હેકર સુધી પહોંચાડી શકે છે. જોકર માલવેર ધરાવતી એપ્લિકેશનમાં Auxiliary Message, Element Scanner, Fast Magic SMS, Free CamScanner, Go Messages, Super Message, Super SMS, and Travel Wallpapers નો સમાવેશ થાય છે. આ એપ્લિકેશનમાં જોકર માલવેર જોવા મળતા ગુગલ દ્વારા આ એપ્લિકેશનને પોતાના પ્લેસ્ટોર પર થી દૂર કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં અન્ય યુઝર આ એપ્લિકેશન ઈન્સ્ટોલ ન કરી શકે. આ પ્રકારના માલવેર, વાઈરસ, ટ્રોજન અને સ્પાયવેર થી બચવા માટે વેબસાઈટ પર આવતી કોઈ પણ પ્રકારની જાહેરાત પર ક્લિક કરવું નહિ અને મોબાઇલમાં જાણીતી અને વેરીફાઈડ એપ્લિકેશન સિવાય અન્ય કોઈ એપ્લિકેશન ઈન્સ્ટોલ ન કરવી જોઈએ. કારણકે આજકાલ આપને મોબાઇલ થી જ મોટેભાગના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. જેથી ભવિષ્યમાં આપને કોઈ મુશ્કેલી ના પડે. @beinghumanmj




વાસ્તુશાંતી પૂજા-યજ્ઞ

વેદોક્ત પદ્ધતિથી સંપૂર્ણ વાસ્તુ શાસ્ત્રથી વાસ્તુ શાંતિ પૂજા યજ્ઞ


ઘર પૂજા સ્થાન છે. ઘરમાં જ સ્વર્ગ છે. ઘરમાં જ શાંતિનો આધાર છે. અને ઘરમાં જ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ છે. પરંતુ જો આ બધી શ્રેષ્ઠતા આપનાં ઘરમાં ના હોય તો ઘરનાં કહેવાય તેને નર્ગ કહેવાય તો આપના નવા ઘરને સ્વર્ગ બનાવવા માટે સચોટ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી વાસ્તુશાંતિ યજ્ઞ થવો જરૂરી છે. કારણ કે જ્યારે નવા ભવનનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેના ભૂગર્ભમાંથી ખોદકામથી આઠ વસ્તુઓ દોષ યુક્ત નિકળે છે તદઉપરાંત નર-અને પશુના અસ્થિ નિકળવાથી ભૂમિદોષ લાગે છે જેનાથી ઘર સ્વર્ગ નહિ પરંતુ નર્ગ બની સ્મશાન જેવું થઈ જાય છે. આવા અશુભ દોષનાં નિવારણ માટે વાસ્તુ શાંતિ યજ્ઞ કરાવવો.

કથા, વાસ્તુ, બેબીશાવર, ગૃહપ્રવેશ, નવચંડી, લઘુરુદ્ર, રુદ્રી પાઠ, ચંડીપાઠ દરેક પ્રકારના હવન અને પૂજા વિધિ કરાવનાર, જન્માક્ષર બનાવવા તથા જોવડાવવા માટે મળો

શાસ્ત્રી મિલનભાઈ ત્રિવેદી આણંદ (બોરસદ) ગુજરાત વાળા
Mobile : 647 770 5984



આપની દરેક સમસ્યાનું સમાધાન સાધના અનુષ્ઠાનથી કરાવવામાં આવશે સચોટ અને શાસ્ત્રોક્ત જ્યોતિષ સલાહ અને નિદાન-વિધાન



નવા, જનમાક્ષર બનાવવા અને જોવડાવવા, કુંડળીમેળાપ, કાલસર્પદોષ, ગ્રહણદોષ પિતૃદોષ, શનીપનોતી, લગ્નયોગ, મકાન-યોગ, ગુપ્તરોગ, દેવુમુક્તિ, શિગ્રવિવાહ, શિગ્રનોકરી પ્રાપ્તિ, બાળકોના ભણવા માટે વિદ્યા યોગ, વિદેશગમન યોગ તથા આપની કોઈપણ ગુપ્ત સમસ્યા, ગુપ્ત રોગ, ગુપ્ત શત્રુનિવારણ માટે મળો. શું આપના બાળકો પુત્ર-પુત્રી ગલત માર્ગથી પાછા વાળવા માંગો છો, શું આપના ઘર પરિવાર ઉપર કોઈએ મેલી વિદ્યા કરેલ છે, શું આપના ઘરમાં હંમેશા લડાઈ-ઝઘડા થાય છે, શું આપનો ભાગ્યોદય થવામાં વિલંબ થાય છે. શું આપના ઘર પરિવાર ઉપર કોઈક સંમોહન વશીકરણ કરેલ છે. શું આપ હંમેશા કોઈ મોટી બિમારીના શિકાર છો તેનો ઈલાજ કર્યા છતાં પણ તેનું નિવારણ નહિ થતું, શું આપનાં વ્યાપાર ધંધાને લગતી કોઈ સમસ્યા છે તો આવી જીવનની દરેક સમસ્યાનાં નિવારણ માટે આજેજ અમારી મૂલાકાત લો અને સચોટ શાસ્ત્રોક્ત વિધાનથી સમસ્યાનું નિવારણ કરાવો.

દરેક પ્રકારના ગ્રહોના નંગ, ચંત્રોગ, સ્ફટિકની માળા, શિવલિંગ, ઘોડાની નાળ, શિયાળાસિંગિ, હથ્થા જોડી, વૈજંતીબિજની માળા, મુંગાની માળા, રુદ્રાક્ષ માળા, મેરુપૃષ્ઠ શ્રી યંત્ર, ગોમતીચક્ર દરેક વસ્તુવિધી કરેલ પ્રાણપ્રતિષ્ઠત વાળી મળશે.





વડોદરાના મ્યુઝિયમમાં 822 વર્ષ જૂની જૈન તીર્થંકરોની ત્રણ પ્રતિમાનું આગમન

ખંભાત અને દાંતામાં આરસની કલાત્મક, નયનરમ્ય પ્રતિમાઓ મળી હતી

વડોદરા

ઐતિહાસિક વિરાસતની ગવાહી આપતા વડોદરા મ્યુઝિયમમાં 822 વર્ષ જૂની જૈન તીર્થંકરોની અત્યંત દુર્લભ પ્રતિમાઓનું આગમન થતાં ઇતિહાસમાં રૂચિ ધરાવતા તેમજ ધર્મભાવનાવાળા ભાવિક લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

ભાવિ પેઢી આપણા ભવ્ય વારસાથી પરિચિત થાય તે માટે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે વર્ષ-1894માં



યુ.કે.ના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ જેવું વડોદરાના કમાટીબાગમાં ભવ્ય મ્યુઝિયમ બનાવ્યું હતું. જેમાં કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન વારસાને સાચવવામાં આવ્યો છે. દેશ-

વિદેશમાં પ્રખ્યાત વડોદરા મ્યુઝિયમમાં ત્રણ નવી ધરોહરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વડોદરાની કલાપ્રેમી જનતા માટે આનંદનો અવસર છે. તાજેતરમાં ખંભાત ખાતે ખોદકામ દરમિયાન જૈન તીર્થંકરની આરસની અત્યંત દુર્લભ પ્રતિમા મળી હતી. 15 કિલોની પ્રતિમા સવાફૂટ ઊંચી અને પોણો ફૂટ પહોળી છે. જેમાં લખેલા લખાણ મુજબ સવંત 1301 એટલે કે 777 વર્ષ પૌરાણિક આ પ્રતિમા છે.

જેણે રસી મુકાવી હોય તેને જ મફતમાં અનાજ મળવું જોઈએ : મંત્રીનું નિવેદન

વડોદરા

સહિત સમગ્ર રાજ્યમાં આજથી મહારસીકરણ અભિયાનની શરૂઆત થઈ ચુકી છે. આ મહારસીકરણ અભિયાન કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિવાદિત નિવેદન આપ્યું હતું. યોગેશ પટેલે જણાવ્યું કે, જેને રસી મુકાવી હોય તેને જ મફત અનાજ મળવું જોઈએ. આ નિવેદનના પગલે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, આ અંગે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે. સમગ્ર રાજ્યમાં સરકાર અને તબીબોની મહેનતને કારણે કોરોનાના બીજા ઘાતક વેવમાંથી બહાર આવવામાં સફળતા મળી છે. હાલ કોરોનાના કેસો નિયંત્રણમાં આવી ચુક્યા છે.

નડાબેટ ઝીરો પોઇન્ટને બોર્ડર ટુરિઝમ કેન્દ્ર હવે સીમાદર્શન તરીકે વિકસાવશે

પાલનપુર

ભારત-પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય બોર્ડર પર આવેલ બનાસકાંઠાની નડાબેટ ઝીરો પોઈન્ટ સીમા દર્શનની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી હતી અને નડાબેટ ખાતે

સીમાદર્શન અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઈ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ

કામોની નિરીક્ષણ કર્યું હતું. સીમાદર્શનનો રૂ. ૧૨૫ કરોડના પ્રોજેક્ટ ના નિર્માણ કામો આગામી ૧૫ ઓગસ્ટ-૨૦૨૧ પહેલા પૂર્ણ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા

જિલ્લાના છેવાડે આવેલ નડાબેટનો સીમા દર્શન પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો હોય મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રવાસન મંત્રી જવાહર યાવડા સાથે ગુરૂવારે

સવારે નડાબેટ આવી પહોંચ્યા હતા જ્યાં નરેશ્વરી માતાના દર્શન કર્યા હતા બાદ પ્રવાસન નિગમ દ્વારા બનાવવામાં આવેલ નરેશ્વરી માતાના મંદિર પાસે વિસામો નરેશ્વરી

મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઈન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના હાથ ધરાયેલા અલગ-અલગ ચાર ફેઈઝ કામોની મુલાકાત લીધી હતી.

125 કરોડના ખર્ચે પ્રવાસન સુવિધાઓ ઉભી કરાશે

ઈલોરાપાર્કમાં હુમલાખોર વાંદરાનો ત્રાસ : ૧૫ દિવસમાં ૨૦ને ઈજા કરી

વડોદરા

વડોદરા ઈલોરાપાર્ક વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી એક વાંદરાના ત્રાસથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઈલોરાપાર્ક વિસ્તારમાં અનેક લોકો પર વાંદરાએ હુમલો કરી ઈજા પહોંચાડી હોવાના બનાવો બન્યા છે. ઈલોરાપાર્ક વિસ્તારની આમ્બુકુંજ સોસાયટીમાં રહેતા ૮૫ વર્ષના અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું કે આ વાંદરાના ત્રાસના કારણે અમોને ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. વાંદરાએ હુમલો કરી મને પગમાં ઈજા પહોંચાડી છે અને તેની સારવાર કરવી પડી છે હજી મારે ૫ ઈન્જેક્શનો લેવાના બાકી છે. આ જ સોસાયટીમાં રહેતી ૮૫ વર્ષની વૃધ્ધા ચંચળબેન મગ સાફ કરતા હતા ત્યારે વાંદરાએ બચકુ ભરી લીધું હતું.

ટોરોન્ટોમાં પ્રિમીયર ડગ ફોર્ડના નિવાસ નજીક છરા સાથે ફરતો શપ્સ ઝડપાયો

ટોરોન્ટો: પ્રિમીયર ડગ ફોર્ડના નિવાસ સામે ખુલ્લા છરા સાથે ધમકીઓ આપનારાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટના સોમવારની રાત્રે બની હતી. ફોર્ડના કાર્યાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ એ વ્યક્તિ જ્યારે ફોર્ડના નિવાસ સ્થાન સુધી આવ્યો ત્યારે સાંજના છ વાગ્યા હશે. તેણે આવતાની સાથે જ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. પોલીસના અહેવાલ મુજબ એ વ્યક્તિએ ફોર્ડના નિવાસ સુધી આવતા પહેલા ઘણાં વાહનોના ટાયર ચીરી નાંખ્યા હતા.

આગંતુક ફોર્ડના નિવાસના મુખ્ય દરવાજા સુધી આવી પહોંચ્યો હતો. સુરક્ષા અધિકારીઓએ અને છરો ફેંકી દેવા અનેકવાર કહ્યું હતું. આખરે એણે છરો ફેંકી દીધો હતો. જો કે તે સમયે ફોર્ડ

ઘરમાં નહોતા. પરંતુ એમના પત્ની ઘટના બન્યાના થોડા સમય બાદ આવી પહોંચ્યા હતા. પોલીસે એ વ્યક્તિની ધરપકડ કરી હતી. જે બદલ ફોર્ડ ત્વરિત કામગીરી બદલ પોલીસનો આભાર માન્યો હતો એમ મંગળવારના નિવેદનમાં પ્રિમીયર કાર્યાલયે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ટોરોન્ટોના ૪૪ વર્ષીય જ્યોર્જ નિરાસની ધરપકડ આ કિસ્સામાં કરવામાં આવી છે. એની સામે ગંભીર ઈરાદા અને હથિયાર રાખવા તેમજ ૫૦૦૦ યુએસ ડોલરથી ઓછી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાના આરોપો લગાડવામાં આવ્યા હતા. મંગળવારે ટોરોન્ટોના પોલીસવડા જેમ્સ રામરે કહ્યું હતું કે આ ઘટના ઘણી ચિંતાજનક છે.



DIVINE YOGA



By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Gratitude Program

Every Thursday 9 PM

Join today on ZOOM!

: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor
416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta



LIFE INSURANCE
MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$ 500,000		\$ 1000,000	
	Male	Female	Male	Female	Male	Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- * NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)
(Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE)
CANCER OR INSURANCE declined by other companies
- * CORPORATION OWNED LIF / CRITICAL ILLNESS INSURANCE
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- * MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits
Email : - Davindersinghfh@gmail.com
www.financialhuttd.com, Davinder Singh Chawla

416.320.4614

Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

SUPER VISA INSURANCE
HARD TO BEAT OUR PREMIUMS

કોરોનામાં ઓનલાઈન ચીટિંગના ગુના 300 ટકા વધ્યાં

ઓનલાઈન ગુનાખોરી રોકવા રાજ્યમાં 10 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત: 10 જિલ્લામાં 10 પોલીસ સ્ટેશન ખોલાશે

અમદાવાદ

પાવર બેન્ક નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૨૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડી, ઘરબેઠાં ડેટા એન્ટ્રીના બહાને ૧૭૦૦ લોકો સાથે ઠગાઈ, નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી રજીસ્ટ્રેશન ફી ઉઘરાવી છેતરપિંડી, બેન્ક એકાઉન્ટમાંથી બારોબાર પૈસા ઉપડી ગયાં.... આવા સમાચારો હવે જાણે રોજીદા બની ગયાં. કોરોના આવ્યો પછી વિતેલા દોઢ વર્ષમાં નાણાકીય લેવડદેવડ વર્ચુઅલ એટલે કે ઓનલાઈન બની છે તે સાથે ઓનલાઈન ચીટિંગના કેસમાં ૩૦૦ ટકાનો તોસ્તાન વધારો નોંધાયો છે. કોરોનાના સમયગાળામાં નેટ બેન્કીંગ, વર્ચુઅલ વોલેટનો ઉપયોગ વધ્યો છે તે



સાથે જ સાયબર કાર્ટમમાં પણ ઉછાળો આવ્યો છે. કોઈપણ નાગરિકના બેન્ક ડેટા કે આધાર કાર્ડ સહિતની વિગતો ચોરી કરીને બિનદાસ્ત વિશ્વના કોઈપણ ખૂણેથી ઈ-ચિટિંગ કરવામાં આવે છે. ઓનલાઈન ગુનાખોરી અટકાવવા માટે ગુજરાત સરકારે સાયબર આશ્રસ્ત પ્રોજેક્ટ શરૂ કર્યો

છે અને રાજ્યભરમાં પોલીસ સ્ટેશનો કાર્યરત કરી ઈ-ચિટિંગના ગુના અટકાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે.

વર્ષ ૨૦૨૦ના આરંભથી કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં સાયબર કાર્ટમમાં ૩૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. કોરોનાથી ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં સાયબર કાર્ટમના કુલ ૧૬૫૦૩ કેસ આવ્યાં છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના આંકડા મુજબ ૧૬૫૦૩ કેસમાં લોકો સાથે કુલ ૬૧ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે તેમાંથી છ કરોડ રૂપિયા સાયબર પોલીસ પરત લાવી શકી છે. આ સમયગાળામાં કસ્ટમર કેર ફોડના ૨૩૮૭, પેટીએમ કેવાયસીના ૨૦૭૩, ઓએલએક્સ ફોડના ૧૮૭૫, કેશબેક ઓફરના

૧૪૦૩, ખોટી ઓલખ આપી ચિટિંગના ૧૧૬૯, નોકરીના બહાને ઠગાઈના ૧૦૫૬ અને કેડીટ-ડેબીટ કાર્ડ ફોડના ૧૦૧૩ ગુના બન્યાં છે.

કોરોના કાળમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન કુલ ૧૪૩૦૦ લોકો ઈ-ચિટિંગની ફરિયાદો કરી ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં જ ઈ-ચિટિંગની અઢળક ફરિયાદો વચ્ચે બે વર્ષમાં ૨૫૦ જેટલા ગુના નોંધાઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં સાયબર કાર્ટમ બ્રાન્ચ ઉપરાંત શહેરના પોલીસ સ્ટેશનોમાં પણ સાયબર કાર્ટમની ફરિયાદો નોંધાઈ રહી છે. અમદાવાદ સાયબર કાર્ટમ બ્રાન્ચ શરૂ કર્યા પછી રાજ્યમાં વધુ ૧૦ સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસ પક્ષમાં ફરી જૂથબંધી વકરી સિનિયર નેતાઓ જ આમનેસામને

અમદાવાદ

સ્વ.અહેમદ પટેલના અવસાન બાદ ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસ પર રાજકીય કબજો મેળવવા ધમપછાડા શરૂ કર્યા છે પરિણામે ફરી કોંગ્રેસમાં જૂથબંધી વકરી છે. કોંગ્રેસ નેતા નરેશ રાવલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં એવો સૂર ઉઠ્યો કે, જુના જોગી નહી, યુવા નેતાને ગુજરાત કોંગ્રેસના સુકાની બનાવો. ગુજરાતમાં વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ વર્ષોથી સત્તાથી વિમુખ છે ત્યારે હજુ આંતરિક ખેંચતાણને કારણે આ સંઘ કાશીએ પહોંચશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. ભરતસિંહ સોલંકીને ફરી ગુજરાત કોંગ્રેસનું પ્રમુખપદ મેળવવું છે

પણ અંદરખાને કોંગ્રેસના મોટા નેતાઓ જ વિરોધ કરી રહ્યાં છે. આ અગાઉ ઠાકોર-કોળી નેતાઓની બેઠકમાં ય અવાજ ઉઠ્યો હતોકે, ભરત સોલંકીના વખતમાં જ કોંગ્રેસ નેસ્તનાબુદ થઈ છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં સારૂ પરિણામ લાવી શક્યા નથી. આ બેઠકમાં ય કોંગ્રેસના નેતાઓનો એક સૂર હતોકે, જૂના જોગીઓ હવે ઝાઝુ ઉકાળી શકે તેમ નથી. આ સંજોગોમાં યુવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ. ટૂંકમાં અહેમદ પટેલ જૂથના નેતા-ધારાસભ્યોએ આડકતરી રીતે ભરત સોલંકી પ્રદેશ પ્રમુખ ન બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

144મી જળયાત્રા : ભગવાન જગન્નાથજીનો જળાભિષેક



ભગવાન જગન્નાથની 144મી જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં જમાલપુર જગદીશ મંદિરેથી નીકળતી રથયાત્રા પૂર્વ જળયાત્રાનો ગજરાજ, દ્વજપતાકા સાથે જળયાત્રાનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મંદિરના મહેંત દિલીપદાસજી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ જોડાયા હતા.

દેશની 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ, સુરત પ્રથમ ક્રમે

સુરત : ગુજરાત માટે વધારે એક ગૌરવ સમાન વાત સામે આવી છે. દેશમાં સ્માર્ટ સિટીઝમાં દેશનાં પ્રથમ 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાના 20 શહેરોમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે. 20 શહેરોમાં સુરતને અગાઉ ચોથું સ્થાન મળ્યું હતું. જો કે અમલીકરણમાં પહેલાથી અગ્રણી સુરત હવે ટોચે પહોંચી ચૂક્યું છે. તો સુરત ચોથા ક્રમે પહોંચ્યું છે. દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં ભોપાલ બીજાક્રમેતતા ઈન્દોર ત્રીજા ક્રમે છે. જ્યારે અમદાવાદ ચોથા



અને વડોદરા (ગુજરાત) 20મા ક્રમે દેખાયું છે. દેશના 100 શહેરો માટે સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ

સિટી ડેવલપમેન્ટ લિમિટેડને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે. સુરત પાલિકા તથા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા 1100 સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગ અરીયા ડેવલપમેન્ટ, ઈકોનોમીક ડેવલપમેન્ટ રિન્યુએબલ એનર્જી, એફોર્બલ હાઉસીંગ, આઈ.ટી કનેક્ટીવિટી અને ડિજિટલાઈઝેશન નોન મોટોરાઈડ ટ્રાન્સપોર્ટ, સીવેજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર સપ્લાય સેક્ટરનાં વિવિધ પ્રોજેક્ટોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

શાહે ગુજરાતની રાજકીય સ્થિતિ સંગઠનના કામનો તાગ મેળવ્યો

અમદાવાદ

અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સરકીટ હાઉસમાં ભાજપના નેતાઓ જ નહીં, ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજીને સંગઠનની કામગીરીથી માંડીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમિત શાહ ભાજપની સંગઠનની કામગીરીથી ભારોભાર નારાજ છે. કોરોનાની બીજી લહેરમાં પક્ષની ધોવાયેલી રાજકીય પ્રતિષ્ઠાને પુન સ્થાપિત કરવા શાહે ભાજપના ટોચના નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. સોમવારે અમિત શાહે અમદાવાદ-

ગાંધીનગરને જોડતા ઓવરબ્રિજોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રાજ્યપાલ સાથે પણ સૂચક મુલાકાત કરી હતી. અમિત શાહના પ્રથમ દિવસના આખા પ્રવાસમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બાદબાકી કરાઈ હતી જે ચર્ચાનો વિષય બની રહ્યો હતો. વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ અમિત શાહ સીધા જ સરકીટ હાઉસ પહોંચ્યા હતાં જ્યાં કોરોના વખતે ભાજપ સંગઠને કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જોકે, ભાજપ આઈટી ટીમના પૂર્વ પ્લાનિંગના અભાવે છેલ્લી ઘડીએ સ્ટેન્ડ પર ટીવી મૂકીને પ્રેઝન્ટેશન દેખાડાયું હતું.

અમદાવાદમાં સોનાના દાગીના પહેરવાના શોખીન કુંજલ પટેલનો આપઘાત

અમદાવાદ

શહેરના માધુપુરા વિસ્તારમાં સિઝિંગના ધંધા સાથે સંકળાયેલા એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર કુંજલ પટેલ ઉર્ફે કે.પી. પટેલ અગાઉ દરિયાપુર વિસ્તારમાંથી એક રાજકીય પાર્ટીના ઉમેદવાર તરીકે પણ ચૂંટણીમાં ઉભો હતો. આપઘાત કરનાર કે.પી સોનાના દાગીના પહેરવાનો શોખીન હતો જેથી તેની ઓળખ વિસ્તારમાં ગોલ્ડ મેન તરીકેની બની ગઈ હતી. કે.પી. પટેલની આત્મહત્યા અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલ યોગેશ સોસાયટીમાં કુંજલ પટેલ નામના વ્યક્તિ રહેતા હતા.

ગુજરાતમાં ફરી વખત ખેડૂત આંદોલનના ભણકારા, આગેવાનોની ગુપ્ત બેઠકો જમી ઉપલેટા, ભાવનગરમાં કૃષિ આંદોલનના સમર્થનમાં દેખાવો

અમદાવાદ

કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા સાતેક મહિનાથી દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આગામી 26મી જૂને પણ ખેડૂતોએ કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યું છે. આ તરફ, કૃષિ આંદોલનના સમર્થનમાં આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ય ખેડૂત સંગઠનોએ દેખાવો કર્યા હતાં. આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર કૃષિ આંદોલન ધમધમે તેવા અંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો

ય કૃષિ કાયદાના વિરોધમાં છે. કેટલાંય ખેડૂતો દિલ્હી બોર્ડર પર જઈને આંદોલનમાં ભાગ લઈ ચૂક્યાં છે. ગુજરાતના ખેડૂતોએ પણ કૃષિ આંદોલનને સમર્થન જારી એક લાખ સહી લેવા લક્ષ્યાંક રાખ્યો હતો. આજે ઉપલેટા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી અને વડોદરા સહિતના શહેરો, જિલ્લા મથકોએ ખેડૂતો કલેક્ટરને આવેદન પત્ર પાઠવી માંગ કરી હતીકે, કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને રદ કરે, અને અસંગઠિત કામદારોને મહિને રૂ.7500 વેતન આપે.

ગુજરાતમાં દારૂબંધીને પડકારતી રિટ હાઈકોર્ટ નહીં સાંભળે : સરકાર

અમદાવાદ

પ્રાઈવસીના અધિકાર હેઠળ ગુજરાતમાં ઘરમાં બેસી દારૂ પીવાની છૂટ મળવી જોઈએ તેવી માગણી કરતી પિટિશનોની મંગળવારે ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. રાજ્ય સરકારે પ્રાથમિક વાંધો દર્શાવી રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૪૯માં જ ગુજરાતના દારૂબંધીના કાયદાની જોગાઈઓને બહાલી આપી હતી. તેથી હાઈકોર્ટે આ પિટિશનો સાંભળી શકે નહીં અને આ પિટિશનો પણ ટકવાપાત્ર નથી. કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ સોનાવણી યોજાઈ હતી.



પાવરબેન્ક કૌભાંડ: દિલ્હીના CAએ નકલી કંપનીઓ ખોલી

એક ડઝન બનાવટી કંપનીના સંચાલકો પકડાયા પણ તેમને તો કૌભાંડની જાણ નથી ! ભૂજ પોલીસ દિલ્હીથી આરોપીને લાવશે

અમદાવાદ : પાવર બેન્ક નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 250 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં ચાઈનીઝ સુત્રધારોની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે. દિલ્હીના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સાધીને 100 શેલ (નકલી) કંપની ખોલવામાં આવી હતી. આ 100 નકલી કંપનીમાંથી કઈ કંપનીમાં રોકાણકારોના નાણાં જશે તેની વ્યવસ્થા પણ ચાઈનીઝ કૌભાંડીઓએ કરી હતી.

મતલબ કે, કરોડો રૂપિયાની હેરાફેરી થતી હતી તેનો સંપૂર્ણ અંકુશ ચાઈનીઝ કૌભાંડીઓએ પોતાની પાસે રાખ્યો હતો. અત્યાર સુધીમાં દિલ્હી, ઉત્તરાખંડ અને

મુંબઈ પોલીસ એક ડઝન બનાવટી કંપનીના સંચાલકોને પકડી તો એવો ઘટસ્ફોટ થયો છે કે, તેમના આઈ.ડી. પ્રૂફ લઈને બનાવટી કંપનીઓ બનાવી લેવાઈ છે. ભૂજમાં ચિટિંગની ફરિયાદ નોંધાઈ તેના નાણાં દિલ્હીની કંપનીમાં જમા થયાં અને આ કંપનીના સંચાલકોનો દિલ્હીથી કબજો લેવા ભૂજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના કાળમાં ઘરબેઠાં મોબાઈલ ફોન એપ્લિકેશનથી એક કા ડબલ કૌભાંડ થકી 250 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડની તપાસમાં અનેક ચોકાવનારા તથ્યો પ્રકાશમાં આવી રહ્યાં છે. ગુજરાતમાં ભૂજમાં એક જ



પરિવારના ત્રણ લોકો રોકાણ કરી છેતરાયાંની અત્યાર સુધી ફરિયાદ થઈ છે. તો, સુરતમાં નકલી કંપની ખોલનાર બે વ્યક્તિને ઉત્તરાખંડ પોલીસે ઝડપી લીધાં છે. ચાઈનાથી સંચાલિત નાણાંકીય કૌભાંડમાં ચોકાવનારી બાબત એ છે કે, 100 બનાવટી કંપનીઓમાં નાણાંકીય

હેરાફેરીનું સંચાલન પણ ચાઈનીઝ કૌભાંડીઓના હાથમાં જ રહેતું હતું.

આ કૌભાંડની અતઃથી ઈતિ એવી છે કે, પાવર બેન્ક નામની એપ્લિકેશન ગુગલ પ્લે પર મુકવામાં આવી હતી અને સોશિયલ મિડિયાથી એની લિન્ક મુકીને લોકોને તોસ્તાન વળતરની લાલચ આપી મેમ્બર બનાવવામાં આવતાં હતાં. મેમ્બર બનતાં લોકોના નાણાં ચાઈનીઝ કૌભાંડીઓએ દિલ્હીના બે સી.એ. થકી ખોલાવેલી 100 શેલ (બનાવટી) કંપનીના ખાતામાં જમા થતાં હતાં. આ બન્ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. સામાન્ય વ્યક્તિઓના આઈ.ડી. પ્રૂફ મેળવી લઈ રજીસ્ટ્રાર ઓફ

કંપનીઓમાં ઓનલાઈન કંપની રજીસ્ટર કરાવી દેવાઈ હતી. આ કંપનીના નામના એકાઉન્ટ બેન્કમાં ખોલાવી લઈ તેમાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયાં હતાં.

નોંધપાત્ર બાબત એ છે કે, કોઈપણ રોકાણકારના પૈસા આવે તે અલગ-અલગ ખાતામાં જમા થાય તેનો કન્ટ્રોલ ચાઈનીઝ કૌભાંડીઓના હાથમાં રહેતો હતો. પોલીસ સૂત્રો કહે છે કે, કૌભાંડનું મૂળ એવી પાવર બેન્ક એપ્લિકેશનનું ડેશ બોર્ડ ચાઈનામાં હતું. ચાઈનીઝ કૌભાંડીઓ 100 એકાઉન્ટન્ટને ટ્રીગર કરી રોકાણકાર પૈસા જમા કરાવે ત્યારે ટ્રાન્ઝેક્શન ફેઈલ ન થાય તેની તકેદારી રાખતાં હતાં.

હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં ૨૦ હજાર, કારમાં દોઢ લાખની સબસિડી મળશે

ગાંધીનગર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે પાટનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં વાહનોના પ્રદૂષણ ઘટાડે તેવા પર્યાવરણમિત્ર વાહનોની ખરીદીને ઉત્તેજન આપવા આવતા ૪ વર્ષ માટે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરી છે, જેમાં ઇ-વ્હીકલના કિલોવોટટીઈ રૂ. ૧૦ હજારની સબસિડી અપાશે. અર્થાત્ ટુ-વ્હીલરમાં રૂ. ૨૦ હજાર સુધીની, રિક્ષા જેવા શ્રી-વ્હીલરમાં રૂ. ૫૦ હજાર સુધીની તથા મોટરકારમાં રૂ. ૧.૫૦ લાખ સુધીની સબસિડી અપાશે, જે વાહન ખરીદનારના બેન્ક

એકાઉન્ટમાં સીધી જમા થશે. આ નવી નીતિ નોટિફાય થયા બાદ તે અમલી બનશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બીજા રાજ્યો ઇ-વ્હીકલની ખરીદીમાં ટેકસમાં, રજિસ્ટ્રેશનમાં રાહતો આપે છે, પણ વાસ્તવમાં એ રાહતો કિંમતની દૃષ્ટિએ પ્રમાણમાં ઓછી હોય છે, અમુક રાજ્યો વાહનોના કિલોવોટટીઈ રૂ. ૫ હજાર સુધીની સબસિડી આપે છે, જ્યારે ગુજરાત જ કદાચ એવું રાજ્ય છે જેણે સબસિડી ડબલ આપી છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ઇ-વાહનોને પ્રોત્સાહન આપતા હતા અને અત્યાર સુધી માંડ ૨ હજાર જેટલા ઇ-વાહનો રસ્તા ઉપર દોડતા હશે.

ગુજરાતના આઠ શહેર વચ્ચે ટૂંક સમયમાં આંતરરાજ્ય ફ્લાઈટ શરૂ કરવા હિલચાલ

અમદાવાદ-ભૂજ-રાજકોટ, સુરત-અમદાવાદ, સુરત-ભાવનગર જેવા ૩૮નો સમાવેશ

અમદાવાદ

કોરોનાને પગલે મોટાભાગના તમામ ક્ષેત્રને આર્થિક ફટકો પડ્યો છે અને તેમાં પ્રવાસનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના પ્રવાસનમાં ફરીથી પ્રાણ ફૂંકવા માટે હવે આગામી ટૂંક સમયમાં આંતરરાજ્ય ફ્લાઈટ વધારવામાં આવી શકે છે. જે ફ્લાઈટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે તેમાં અમદાવાદ-રાજકોટ-ભૂજ-અમદાવાદ, અમદાવાદ-સુરત-અમદાવાદનો મુખ્યત્વે સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે બધું જ આયોજન



મુજબ પાર પડ્યું તો બે મહિનામાં આ આંતરરાજ્ય ફ્લાઈટ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં કુલ પાંચ રૂટ પર આંતરરાજ્ય ફ્લાઈટ શરૂ કરવા માટેનો ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં

અમદાવાદ-ભૂજ-રાજકોટ-અમદાવાદ, અમદાવાદ-કેશોદ-પોરબંદર-અમદાવાદ, સુરત-અમદાવાદ-સુરત, સુરત-ભાવનગર-સુરત અને સુરત-અમરલી-સુરતનો સમાવેશ થાય છે. 'ઉડાન' યોજના હેઠળ આ પ્રસ્તાવિત ફ્લાઈટ શરૂ કરવા માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આગામી સમયમાં આ ફ્લાઈટ માટે બિડ મૂકવામાં આવે તેની પણ સંભાવના છે. આ ફ્લાઈટ સમાહમાં ૬ દિવસ માટે ઉડાન ભરશે અને એક દિવસ મેઈન્ટેનન્સ માટે આપવામાં આવશે.

કોરોનાને લીધે આર્થિક ભીંસ: વિશ્વામિત્રી પ્રોજેક્ટ ફરી વાર અભરાઈ પર ચડી જશે

વડોદરા

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને સુંદરતા વધારવાના detail પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા પાછળ સવા કરોડનો ખર્ચ થયો હતો હવે જ્યારે પાવાગઢ થી પાદરા તાલુકાના પીન્ગલ વાડા ગામ સુધી 178 કિલોમીટર સુધીની વિશ્વામિત્રી નદી સુંદરતા વધારવાનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર અમલમાં મૂકવાની વાતો શરૂ થઈ છે ત્યારે હાલની કોરોના મહામારી અને સરકારની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોવાને લીધે આ પ્રોજેક્ટ ફરી



એક વખત અભરાઈ પર ચડાવી દેવામાં આવશે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે ફરી એકવાર ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા પાછળ લોકોના પૈસા નો ધુમાડો કરાશે.

વિશ્વામિત્રી નદીની સુંદરતા વધારવા શુદ્ધિકરણનો પ્રોજેક્ટ શરૂ થયો હતો પરંતુ આજ દિન સુધી તેનું કોઈ અમલ થયો નથી એટલું જ નહીં તેની પાછળ રૂપિયા ૩૦ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે છતાં વિશ્વામિત્રીમાં ગંદુ પાણી ઠલવાતું રહ્યું છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ ના અમલીકરણ માટે અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના 17 કિલોમીટરના વિસ્તારનો detail પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

યુનિ.-કોલેજોના સ્ટેટ રેટિંગ જાહેર, ગુજરાત યુનિ.ને ફાઈવ સ્ટાર મળ્યા

વડોદરા

ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૦-૨૧ના યુનિવર્સિટી અને કોલેજોના રેટિંગ આજે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફેમલકમાં ગુજરાત યુનિવર્સિટીએ ગત વર્ષની માફક આ વર્ષે પણ ફાઈવ સ્ટાર રેન્ક જાળવી રાખ્યો છે. ગત વર્ષે ચોથા રેન્ક પર રહેલી જીટીયુ આ વર્ષે ક્યાંય નથી. રાજ્યની ૭૦ પૈકી ૩૫ યુનિવર્સિટીઓ અને ૧૯૦ કોલેજોએ ભાગ લીધો હતો. ગત વર્ષે કરતા આ વર્ષે રેટિંગમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓની સંખ્યામાં ૨૧ ટકાનો વધારો થયો છે. કુલ ૮ યુનિવર્સિટીએ પ્રથમ વખત ભાગ લીધો હતો. જેમાં ફાઈવ સ્ટાર મેળવેલી

યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદ, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી-ગાંધીનગર, નિરમા યુનિવર્સિટી-અમદાવાદ, સેપ્ટ યુનિવર્સિટી-અમદાવાદ, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી-જૂનાગઢનો સમાવેશ થાય છે જ્યારે ફાઈવ સ્ટાર મેળવેલી કોલેજોમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ એન્ડ રિસર્ચ-આણંદ, સેન્ટ.એવિયસ કોલેજ-અમદાવાદ, ચંદનબેન મોહનભાઈ પટેલ ઈન્સ્ટિ. ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન-આણંદ, વિરાણી સાયન્સ કોલેજ-રાજકોટ, પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ-સુરતનો સમાવેશ થાય છે.

હાલ કોઈ જ મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય, બધી વાતો હવામાં : રૂપાણી

અમદાવાદ

અમદાવાદ : ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની યોજાયેલી બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણની રાજકીય અફવાએ જોર પકડ્યું હતું પણ હાલ મંત્રીમંડળનું કોઈ વિસ્તરણ નહીં થાય તેમ કહી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપીય વાત પર જ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. વર્ષ 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી તૈયારીઓ આદરી છે ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી રાજકીય હલચલ તેજ બની છે.એટલું નહીં, ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નેતાઓ સાથે વન દુ વન બેઠકો યોજતા મંત્રીમંડળમાં ફેરબદલ થઈ રહ્યા છે તે મુદ્દે રાજકારણ ગરમાયું હતું.

અમદાવાદ એરપોર્ટમાં ચાર્ટર્ડ ફ્લાઈટ માટે હવે અલાયદું ટર્મિનલ બનાવશે

અમદાવાદ

દેશના સૌથી અતિવ્યસ્ત એવા મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર ડોમેસ્ટિકની સાથે ચાર્ટર્ડ ફ્લાઈટોની આવનજાવન વધુ છે. હવે ધીમેધીમે અમદાવાદ એરપોર્ટ પણ તેની હરોળમાં આવી રહ્યું છે. એરપોર્ટ પર પણ ચાર્ટર્ડ ફ્લાઈટોમાં ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ, મંત્રીઓ સહિતના વીવીઆઈપીની મુવમેન્ટ વધતા તેમની અલગ પ્રકારની વ્યવસ્થા આપવાના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર જનરલ સિવિલ એવિએશન ટર્મિનલ બનાવશે, જેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.



એરપોર્ટ ઓથોરિટીના વખતે બનાવાયેલા સેરેમોનીયલ હોલ બનાવાયો હતો. આ હોલમાં ચાર્ટર્ડ કે શેડયુઅલ ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ વીવીઆઈપીઓને કોઈ મિટીંગ કરવી હોય તો તેઓ ત્યાં કરી શકતા હતા તેમજ ઓથોરિટી દ્વારા પણ ઉપયોગ થતો હતો.

ચૂંટણીમાં VVPATની માગણી કરતી રિટ ફગાવી રૂપિયા 500નો દંડ કરાયો

અમદાવાદ

સ્થાનિક ચૂંટણીઓમાં વી.વી.પેટ મશીનનો ઉપયોગ, અનામત બેઠકોની જોગવાઈ તેમજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થતી ગેરરીતિઓની યાદી બનાવવાની માગણી સાથે થયેલી જાહેર હિતની અરજ ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે અને અરજદારને રૂપિયા ૫૦૦નો દંડ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે પી.આઈ.એલ.ની જોગવાઈનું આ મોટું અને પુખ્ત ઉદાહરણ છે. ચૂંટણીઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક-શૈક્ષણિક પછાત સમુદાય, મહિલાઓ માટે અનામત બેઠકો રાખવા, વી.વી.પેટ મશીનનો ઉપયોગ કરવા તેમજ રાજ્ય ચૂંટણી પંચની ગેરરીતિઓની યાદી બનાવવાની માગણી કરતી પિટિશન અરજદારે કરી હતી.

ઉત્તર પ્રદેશ ધર્માતરણના તાર ઝાકીર નાઈક સહિત અનેક સાથે જોડાયેલા છે : ATS

ઉમર ગૌતમનું કનેક્શન ઝાકીર નાઈકની સંસ્થા ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સાથે હોવાનું બહાર આવ્યું

નવી દિલ્હી

ધર્માતરણ સાથે સંકળાયેલા કેસની તપાસમાં લાગેલી યુપી એટીએસને ઘણી મહત્વની માહિતી મળી છે, ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર સાથે થયેલી પુછપરછમાં જાણવા મળ્યું છે કે ધર્માતરણ કેસનાં તાર ઝાકીર નાઈક સાથે જોડાયેલા છે, વળી ઉમર ગૌતમનું કનેક્શન ઝાકીર નાઈકની સંસ્થા ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સાથે હોવાનું પણ બહાર આવ્યું છે.

કેઝ સૈયદનાં ઉમર સાથે નજીકનાં સંબંધ છે, ઝાકીર નાઈકની સંસ્થા પ્રતિબંધ પહેલા ઇસ્લામિક યૂથ ફાઉન્ડેશનને ફંડિંગ કરે છે, આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકો પણ ઉમર સાથે સંપર્કમાં હતાં, યુપી એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે, કે ધર્મ પરિવર્તનનો આ ખેલ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતાં. ઉમર ગૌતમે અત્યાર સુધીમાં ઇસ્લામિક દાવા

સેન્ટર દ્વારા મોટી સંખ્યામાં લોકોનું ધર્માતરણ કર્યું છે. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં ૩૩ લોકોની યાદી પણ મળી છે. આ યાદીમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહારના ઘણા યુવાનોના નામનો પણ સમાવેશ થાય છે. ધર્મપરિવર્તનનાં ફોર્મ પર જહાંગીર કાઝીનું નામ છાપવામાં આવ્યું છે. માહિતી અનુસાર, ૭ મી જાન્યુઆરી, ૨૦૨૦ થી ૧૨ જૂન ૨૦૨૧ સુધી ૩૩ લોકોનું ધર્માતરણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ મહિલાઓ અને ૧૫ પુરુષો સામેલ છે.

જિઓ ગૂગલ સાથે મળી સસ્તો સ્માર્ટફોન જિઓ નેક્સ્ટ લાવશે મુંબઈ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી એજન્ડામાં ચેરમેન મુકેશ અંબાણીએ આગામી દિવસોમાં રિલાયન્સ જિઓ અને ગૂગલની પાર્ટનરશિપનું એલાન કર્યું હતું. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં જિઓ અને ગૂગલ દ્વારા નવો અને સસ્તો સ્માર્ટફોન જિઓ નેક્સ્ટ લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન જિઓ તેમજ ગૂગલના ફિચર સાથે સજ્જ હશે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ અને જિઓએ સંયુક્ત રીતે ડેવલપ કરેલી છે. આ સ્માર્ટફોન દરેક માણસના ગજવાને પરવડે તે રીતે બનાવવામાં આવ્યો છે. તેની કિંમત સાવ ઓછી હશે અને ૧૦ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે ફોનને લોન્ચ કરવામાં આવશે.

પાડોશીના ત્રાસથી પૂર્વ મહિલા પત્રકારની પુત્ર સાથે આત્મહત્યા

રેશમાની સ્યુસાઈડ નોટના આધારે પાડોશી ઐયુબખાનની ધરપકડ

મુંબઈ

મુંબઈના અંધેરી વિસ્તારમાં સર્જાયેલી એક કરુણાંતિકામાં પાડોશીની હેરાનગતિથી કંટાળી ગયેલી પૂર્વ મહિલા પત્રકારે પોતાના સાત વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી હતી. મળતી વિગતો પ્રમાણે પૂર્વ પત્રકાર રેશમાના પતિનું એક મહિના પહેલા કોરોનાથી મોત થયા બાદ તે પહેલેથી જ ભાંગી પડી હતી. દરમિયાન પોલીસે રેશમાના પાડોશી ઐયુબ ખાનની ધરપકડ કરી છે. રેશમાએ પોતાની સુસાઈડ નોટમાં ઐયુબ ખાન અને તેના પરિવાર પર માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. સુસાઈડ

નોટમાં રેશમાએ કહ્યું હતું કે, મારા પાડોશીઓ મારા સાત વર્ષના પુત્રને રમવા દેતા નથી. આ બાબતે તેઓ અવારનવાર મારી સાથે ઝઘડો કરે છે. આ પહેલા રેશમાએ ૩૦ મેના રોજ પોતાની ફેસબૂક પોસ્ટ પર પણ પાડોશી દ્વારા પુત્રને હેરાન કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન સોમવારે રેશમાએ ૧૨માં માળ પરથી પોતાના પુત્ર સાથે મોતનો ભૂસકો માર્યો હતો. જોકે હજી સુધી તેમનો અંતિમ સંસ્કાર થઈ શક્યો નથી. કારણકે તેમના પરિવારનો કોઈ સભ્ય મુંબઈમાં નથી. પોલીસ રેશમાનો ભાઈ અમેરિકાથી પાછો ફરે તેની રાહ જોઈ રહી છે.

ક્લાસીફાઈડ / Classified

MOTEL HELP WANTED

Need one person for motel work located in north of Ontario 2.5 hr. from Toronto. Fully furnished accommodation will be provided, family can stay together. Work includes of office work, room making, general work and cleaning. If two people willing to work together one can get a work in our restaurant (separate). Interested can send resume on below E-Mail. jobformotel@gmail.com

બેઝમેન્ટ ભાડેથી આપવાનો છે.
(કીલ-લોરેન્સમાં)

કીલ-લોરેન્સ ઈન્ટરસેકશન ખાતે સંપૂર્ણ રીનોવેટેડ અને વોડઆઉટ બેઝમેન્ટ ભાડેથી આપવાનો છે જે તમામ ઉપકરણોથી સજ્જ. બધી બેંકોથી વોકેબલ ડીસ્કોન્ટ, ટીટીસી/મેટ્રો/વોલમાર્ટ/કલીનિક અને અન્ય સ્ટોર્સથી પણ નજીક. સ્ટુડન્ટસને પહેલી તક અપાશે.

સંપર્ક કરો :- ૪૧૬-૮૨૫-૪૭૧૪ or
Email :- basil_daniel@yahoo.ca. વહેલા તે પહેલાના ધોરણે

૨૦૫૩ લોકોને બોગસ રસી આપવાનું કૌભાંડ : પાંચ FIR દાખલ મુંબઈ

મુંબઈમાં કેટલાક લોકો દ્વારા જુદાજુદા વિસ્તારોમાં બોગસ વેક્સિન કેમ્પ ચલાવવામાં આવતા હોવાની ફરિયાદો મળી હતી. આ પછી મુંબઈ પોલીસ દ્વારા બોગસ વેક્સિન કેમ્પ ચલાવતા લોકોને પકડવા ઝુંબેશ હાથ ધરાઈ હતી. શહેરનાં પાંચથી વધુ વિસ્તારોમાં ૨૦૫૩ લોકોને બોગસ વેક્સિન આપવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ સંદર્ભમાં પાંચ FIR કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ અધિકારીએ બોમ્બે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, કાંદીવલી, બોરિવલી, ખાર, વરસોવા તેમજ પરેલ ખાતે બોગસ વેક્સિનેશન કેમ્પ લગાવવામાં આવ્યા હતા. જેમાં ૨૦૫૩થી વધુ લોકોને બનાવટી વેક્સિન આપવામાં આવી હતી. આ સંદર્ભમાં પાંચ FIR કરવામાં આવી છે અને ૪૦૦થી વધુ લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે.

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના પહેલા પ્રકરણ (સુરાહ અલ ફાતિહા) અને તેનો પદ્યમય ભાવાનુવાદ

ભાગ-૨

કુરાન મજીદના પહેલા પ્રકરણ “સુરાહ અલ ફાતિહા”નો પદ્યમય ભાવાનુવાદ ભારતમાં તો કદાચ એકાદ બે કવિઓએ કર્યો હશે, પણ પાકિસ્તાનમાં આ પ્રયાસ પાકિસ્તાનના એક નામાંકિત કવિ જનાબ દીપક બારડોલીકરે પ્રથમ અને બહુ જ પ્રશસ્ત્ય રીતે કરેલ છે. જનાબ દીપક બારડોલીકર હાલમાં બ્રિટનમાં વસવાટ કરે છે. નીચે જનાબ દીપક બારડોલીકર કૃત કુરાન મજીદના પહેલા પ્રકરણ “આરંભ” (સુરાહ અલ ફાતિહા) નો પદ્યમય ભાવાનુવાદ આપવામાં આવેલ છે. પદ્યમય ભાવાનુવાદ એટલે પદ્યમાં ભાવાર્થ અને ન કે શબ્દ શબ્દ ભાષાંતર.



મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના બોધવચનો પર આધારિત

બિસ્મિલ્લાહીર રહમાનીર રહીમ :-
કરૂં રબનામથી આરંભ, જે મોટો કૃપાળુ છે, નથી જેની દયાનો પાર, જે અનહદ દયાળુ છે.
(રબ = પાલનહાર, અલ્લાહ)
સુરાહ અલ ફાતિહા :-
(૧) ફક્ત અલ્લાહના માટે અતિ ઉત્તમ પ્રશંસાઓ, ભલાઈ, બંદગી, ભક્તિ અને છે સર્વ ગુણગાનો, બહુ સુંદર, અનુપમ સર્વ સૃષ્ટિનો જે સર્જક છે, સકળ સંસારનો માલિક, દશે દિશનો જે શાસક છે.
(૨) કણેકણ પર દયાદ્રષ્ટિ છે તેની, તે દયાળુ છે, કરુણાવંત છે મોટો અને બેહદ કૃપાળુ છે.
(૩) કયામતના દિવસનો તે, ફક્ત તે એક છે આકા, નહિ ત્યાં અન્ય કોઈની લગીરે ચાલશે આજ્ઞા (આકા=માલિક)
(૪) અમે કરીએ છીએ બસ બંદગી તારી, ફક્ત તારી, તમન્ના છે, મળે તારો જ ટેકો ને મદદ તારી.

(૫) બુદાવંદ, તું રસ્તો ચીંધજે સીધો - સકળતાનો, હદયની શુધ્ધતાનો, ભવ્ય ઈન્સાની મહત્તાનો.
(૬) સુભાગી એ જનોનો ચીધ જે રસ્તો કે જેઓ પર, થઈ તારી કૃપાવર્ષા, રહી મીઠી નજર અકસર. (અકસર=ઘણીવાર)
(૭) નથી ઈચ્છા મળે તે દુર્જનોના દૃષ્ટ રસ્તાઓ, વરસ્તી જેમના ઉપર રહી તવ કોપ જવાળાઓ, બપે ના તેમનો મારગ, થયા ગુમરાહ જે લોકો ગયા અવળી દિશામાં ને થયા બર્બાદ જે લોકો (ગુમરાહ=ભટકી ગયેલા, આડા રસ્તે ગયેલા) - દીપક બારડોલીકર

“સુરાહ અલ ફાતિહા”ની વિશિષ્ટતા :
આ “સુરાહ અલ ફાતિહા” કુરાન મજીદની પહેલી સુરાહ હોવાના કારણે તેને “ઉમ્મુલ કિતાબ” પણ કહેવામાં આવે છે. અરબી ભાષાના શબ્દ “ઉમ્મ”નો અર્થ “માતા” થાય છે, જે પોતાના બાળકના અસ્તિત્વ, પોષણ અને સુધારા માટે શરૂઆત, પાયા અને મુળરૂપ હોય છે. તેવીજ રીતે આ સુરાહમાં કુરાન મજીદના સમગ્ર જ્ઞાનનો ખુલાસો મુળરૂપ અને પાયા સમાન છે. એ પ્રમાણે “ઉમ્મુલ કિતાબ”નો અર્થ “શાસ્ત્રનું મુળરૂપ” કે “ધર્મશાસ્ત્ર નો પાયો” પણ કહી શકાય. આ સુરાહને “સુરાહ અલહમ્દ” અને “સુરાહ

હમ્દ” પણ કહેવામાં આવે છે. અરબી ભાષાના શબ્દ “હમ્દ”નો અર્થ “પ્રશંસા” થાય છે. અને તે પ્રમાણે આ સુરાહનો આરંભ પાલનહાર અલ્લાહની પ્રશંસાથી થાય છે.
ઈસ્લામના અંતિમ પયગંબર સાહેબ હઝરત મોહંમદ સાહેબ (સ.અ.વ.)ના એક કથન (હદીસ) અનુસાર આ સુરાહ બિમારીની સામે એક ઉપચાર (શીફા) સમાન છે. (હદીસ પુસ્તક બુખારી). તેનો ખુલાસો એ છે કે બિમારીના સમયે આ સુરાહનું પઠન જરૂર કરવું જોઈએ અને અંતકરણથી પાલનહાર અલ્લાહથી બિમારીને દુર કરી દેવા માટે યાચના (દુવા) કરવી જોઈએ.
આ “સુરાહ અલ ફાતિહા”ના આરંભમાં પાલનહાર અલ્લાહની પ્રશંસાની સાથે તેનું વ્યક્તિગત(જાતી) નામ “અલ્લાહ” તથા તેના ભાવવાચક (સીફાતી) નામો “રબ” (પાલનહાર), “રહમાન” (અત્યંત કૃપાળુ) તથા “રહીમ” (દયાળુ)નો સમાવેશ થાય છે.
આ “સુરાહ અલ ફાતિહા” જગતના દોઢ અબજ મુસ્લિમ શ્રદ્ધાળુઓ માંથી લગભગ દરેક શ્રદ્ધાળુને કંઈસ્તે યાદ હોય છે અને ત્યાં સુધી કે એક ત્રણ ચાર વર્ષનો બાળક, જેની માતૃભાષા અરબી નથી હોતી, તે પણ અરબી ભાષાની આ સુરાહ બહુ જ સહેલાથી કંઈસ્તે યાદ કરી લે છે. અવાર નવાર આ સુરાહનું પઠન (તીલાવત) કરવાથી તે થકી પાલનહાર અલ્લાહની પ્રશંસા પણ થાય છે અને તેમાં આવેલી યાચિકા(દુઆ)નો પણ ઉદ્દેશ પુર્ણ થઈ જાય છે. માટે દરેક શ્રદ્ધાળુ એ આ સુરાહનું બંદગી (નમાઝ) ઉપરાંત અચુક તેનું દૈનિક મૌખિક પઠન અવશ્ય કરવું જોઈએ. સમાપ્ત



કોરોના ધીમી ગતિએ આગળ વધ્યાં, 54,069 કેસ

નવી દિલ્હી ।

કોરોના મહામારીનો સેકન્ડ વેવ ધીમો પડી રહ્યો હોવાના દાવાઓ વચ્ચે દેશમાં કોરોનાનો ગ્રાફ ફરી ઊંચો ચઢવા લાગ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના નવા ૫૪,૦૬૯ કેસ નોંધાયા હતા. આ પહેલાં મંગળવારે કોરોનાના નવા કેસ ૫૦,૦૦૦ની સપાટી નીચે ચાલ્યા ગયા હતા, પરંતુ હવે સતત બીજા દિવસે ૫૦,૦૦૦ કરતા વધુ કેસ સામે આવ્યા છે. બુધવારે ભારતમાં કોરોનાના નવા



૫૦,૮૪૮ કેસ નોંધાયા હતા. આમ ભારતમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩,૦૦,૮૨,૭૭૮ થઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૨૧ દર્દીએ જીવ ગુમાવ્યા હતા. જેના પગલે મહામારીનો કુલ મૃતાંક ૩,૮૧,૯૮૧ થયો હતો.

જોકે દેશમાં કોરોના મહામારીમાંથી રિકવર થતા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા સતત વધારે રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૮,૮૮૫ દર્દી રિકવર થયાં હતાં. આમ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધુ ઘટીને ૬,૨૭,૦૫૭ ઉપર આવી ગઈ હતી. ૨૪ કલાકમાં ૧૬,૧૩૭ એક્ટિવ કેસ ઘટ્યા હતા. દેશમાં કોરોના મહામારીને માત આપનારા કુલ દર્દીઓની સંખ્યા ૨,૮૦,૬૩,૭૪૦ થઈ છે. નેશનલ રિકવરી રેટ ૯૬.૬૧ ટકા થયો છે. વીકલી રિકવરી રેટ સતત ૧૭મા દિવસે ૩.૦૪ ટકા અને ૩૧મી પોઝિટિવિટી રેટ ૨.૯૧ ટકા રહ્યા હતા.

મધ્યપ્રદેશમાં ડેલ્ટા+ના 5 કેસ : એકનું મોત

ભારતમાં ડેલ્ટા પ્લસ વાઈરસના કુલ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે દેશમાં કુલ ૪૦ કેસ હોવાનું જણાવ્યું હતું ત્યાં ગુરુવારે મધ્યપ્રદેશમાં વધુ પાંચ કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વાઈરસના સંક્રમણના પાંચ નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી એક દર્દીનું મોત થઈ ગયું છે. બીજા તરફ ચાર દર્દીઓએ કોરોનાની રસી લીધી હોવાથી તેમની હાલત સ્થિર છે.

બીજી લહેર સરકારની બલિહારી : મમતા

ભાજપના નેતા જેપી નહાએ તાજેતરમાં જ કોરોના વાઈરસ વેક્સિનેને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. ત્યારે મમતા બેનર્જી આ નિવેદનના કારણે ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે કોરોના મહામારીની બીજી લહેર માટે કેન્દ્રની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી હતી. જેપી નહાએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જે પહેલા વેક્સિનેશનને લઈ રાજનીતિ કરી રહ્યા હતા.

ચીને ભારતીય સરહદે તિબેટીયન યુવાઓની સૈન્ય ટુકડી તૈનાત કરી ચીનનો તિબેટીયન યુવાઓને ભડકાવવાનો પ્રયાસ

નવી દિલ્હી

ભારત સરહદે ચીન પોતાની તાકાત વધારી રહ્યું છે. ચીને હવે કબજે કરી લીધેલા તિબેટના યુવાઓને પોતાના સૈન્યમાં સમાવવા લાગ્યું છે. આ માટે ચીને તિબેટીયન યુવાઓના સૈન્યની પ્રથમ ટુકડીને ચુમ્બી ઘાટીમાં તૈનાત પણ કરી દીધી છે. ભારત સાથેની તકરારો વચ્ચે ચીને નવી રણનીતિ અપનાવી તિબેટીયન યુવાઓને જ પોતાની ઢાલ બનાવવાનું કાવતરું ઘડી કાઢ્યું છે. ચીને પચાવી પાડેલા તિબેટના ચુમ્બી ઘાટીમાં તિબેટીયન

યુવાઓ વાળી સૈન્યને તૈનાત કરી દીધી છે. હાલ ચીન તિબેટ ઓટોનોમસ રીજન (ટીએઆર)માં મોટા પાયે તિબેટીયન યુવાઓની ભરતી પ્રક્રિયા ચલાવી રહ્યું છે. વધુમા વધુ સ્થાનિક યુવકોનો તેમાં સમાવેશ કરાઈ રહ્યો છે. તિબેટીયન યુવાઓનો સમાવેશ કરતી આવી સૈન્યની બે ટુકડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. હાલ એક ટુકડીને તૈનાત પણ કરી દેવામાં આવી છે. દરેક ટુકડીમાં આશરે ૧૦૦ યુવાઓનો સમાવેશ કરાયો છે. એક ટુકડીની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે.

હિમાચલના સીએમ જયરામ ઠાકુરના સુરક્ષા કર્મી અને પોલીસ વચ્ચે મારપીટ

કાફલામાં યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સુરક્ષા કર્મી અને પોલીસ અધિકારી બાખડયા

શિમલા

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી કુલુ પહોંચતા જ હિમાચલ પોલીસની શિસ્તબદ્ધતાના દાવાની પોલ ખુલ્લી પડી ગઈ. ગડકરી આવ્યા તે સમયે જ ભુંતર એરપોર્ટની બહાર પોલીસ વડા ગૌરવ સિંહ અને મુખ્યમંત્રી જયરામ ઠાકુરના સુરક્ષા અધિકારીઓ વચ્ચે મારામારી થઈ.

નીતિન ગડકરીના કાફલામાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરનું વાહન પાછળ હોવાના કારણે ભુંતર એરપોર્ટની



બહાર પોલીસ વડા ગૌરવસિંહની સાથે સુરક્ષા અધિકારી વૃજેશ સૂદનો વિવાદ થયો. ગૌરવસિંહે આવેશમાં આવીને મુખ્યમંત્રીના સુરક્ષા અધિકારી વૃજેશ સૂદને થપ્પડ મારી. મુખ્યમંત્રીના સુરક્ષા

અધિકારીઓને આ વાતની ખબર પડી ત્યારે તે પણ આવેશમાં આવી ગયા અને તેમણે પોલીસ વડા સાથે ધક્કામુક્કી કરી. આ ઘટના બની ત્યારે જયરામ ઠાકુર ગાડીમાં જ બેઠા હતા. તેમણે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ત્રણ દિવસમાં તેનો અહેવાલ માંગ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળવા માટે ભુંતરમાં ફોરલેન પ્રભાવિત ખેડૂત સંઘના હોદ્દેદારો તેમને મળવા ગયા હતા. નીતિન ગડકરીનો આવો કોઈ કાર્યક્રમ ન હતો.

મુંબઈની એક હોસ્પિટલમાં ઉદરો એક દર્દીની આંખ કાતરી જતાં ખળભળાટ

દર્દીની આંખને ફક્ત માત્ર ઉપરના હિસ્સામાં ઈજા થઈ છે : હોસ્પિટલ તંત્ર

મુંબઈ

મુંબઈની એક હોસ્પિટલમાં ઉદરો એક દર્દીની આંખ કાતરી ગયા હોવાની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ વ્યાપી ગયો છે. ચેલપ્પા નામના ૨૪ વર્ષના દર્દીએ આરોપ મુક્યો હતો કે, મારી આંખ નજીકના હિસ્સાને ઉદરો કાતરી ગયા હતા અને તેનાથી આંખને નુકસાન પહોંચ્યું છે. મંગળવારે ઘાટકોપર વિસ્તારમાં આવેલી બીએમસીની રાજાવાડી હોસ્પિટલમાં આ ઘટના બની હતી.

હોસ્પિટલના તંત્રનું કહેવું છે કે, દર્દીની આંખને કોઈ નુકસાન થયું નથી. માત્ર આંખની ઉપરના હિસ્સામાં ઈજા થઈ છે. ચેલપ્પાની બહેનના કહેવા પ્રમાણે હાલમાં જ મારા ભાઈની આંખની સર્જરી કરવામાં આવી હતી. હું તેમને મળવા માટે ગઈ ત્યારે ડાબી આંખ પર ઈજાનું નિશાન દેખાયું હતું. આ બાબતની મેં ડોક્ટરોને જાણકારી આપી હતી. એ પછી મારા ભાઈને બીજા બેડ પર શિફ્ટ કરવામાં આવ્યો હતો.

હાલત ગંભીર છે. જ્યારે હોસ્પિટલના ડીનનું કહેવું છે કે, આંખમાં કોઈ આજ્ઞા નથી અને સારવાર ચાલી રહી છે. જોકે આ ઘટનાને ટાળી શકાઈ હોત. ગ્રાઉન્ડ ફ્લોર પર લોકો કચરો ફેંકે છે ત્યારે ઉદરો ત્યાં પહોંચી જાય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અંગે સતર્કતા રાખવામાં આવશે. દરમિયાન આ વાતની જાણ થતા મુંબઈના મેયર પણ દર્દીને મળવા માટે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું તહુ કે, ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બહેનનું કહેવું છે કે, ચેલપ્પાની

ડૂગસ કેસમાં પ્રોડક્શન વોરંટ ઉપર દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરાઈ

મુંબઈ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની મુંબઈ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી દ્વારા બુધવારે ધરપકડ કરવામાં આવી છે. ડૂગસ કેસમાં પ્રોડક્શન વોરંટ ઉપર ઈકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી છે.હાલમાં જ એનસીબીએ ચરચની બે કંસાઈનમેન્ટ પકડ્યા હતા. જેને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઈ બાઈક પર લઈને આવ્યા હતા. આ કેસમાં લગભગ 25 કિલો ચરસ પકડાયું હતું. એનસીબીને તેમાં અંડરવર્લ્ડ સાથે તાર જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની કસ્ટડી એનસીબીએ લીધી છે.

2435 કરોડ કૌભાંડને મામલે કોમ્પટન ગ્રિવ્જના પૂર્વ ચેરમેન સામે કેસ દાખલ

નવી દિલ્હી

આઈએ યસ બેન્ક અને અન્ય બેન્કોના કોન્સોર્ટિયમ સાથે રૂપિયા ૨૪૩૫ કરોડની છેતરપિંડીમાં એક નવો કેસ નોંધી કોમ્પટન એન્ડ ગ્રિવ્જ પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સના પૂર્વ ચેરમેન ગૌતમ થાપરના મુંબઈ, દિલ્હી, ગુરુગ્રામ સહિત છ સરનામે રેડ પાડીને તપાસ હાથ ધરી હતી. આવા અનેક કેસમાં થાપર સામે તપાસ ચાલી રહી છે. સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ કંપની ભૂતકાળમાં કોમ્પટન ગ્રિવ્જ લિમિટેડ તરીકે ઓખખાતી હતી.



સીબીઆઈ ગૌતમ થાપર સામેના લોન રિફોલ્ટ કેસમાં મુંબઈ અને દિલ્હીના અનેક સરનામે દરોડા પાડીને તપાસ કરી રહી છે. મુંબઈના સીજી હાઉસ સહિતના છ સરનામે સીબીઆઈ અધિકારી દરોડા પાડીને તપાસ કરી રહ્યા હતા.

PM વડાપ્રધાન મોદી અંગે કરેલી ટિપ્પણી કટાક્ષથી વધુ કંઈ નથી : રાહુલ ગાંધી

સુરત

બેંગ્લોર નજીક આવેલા કોલાર ખાતેની એક જાહેર સભામાં બધા ચોર મોદી કેમ હોય છે એ પ્રકારની ટિપ્પણી સામે થયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સુરત કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષના નિવેદનમાં રાહુલ ગાંધીએ એક તરફ મોટાભાગના પ્રશ્નોમાં પોતાને કોઈ જાણ નહીં હોવાનું રટણ કર્યું હતું. જ્યારે એક માત્ર સ્પષ્ટ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, મોદી નામની કોઈ જ્ઞાતિ નથી અને પોતે રાષ્ટ્રીય નેતા હોવાને કારણે પ્રધાન મંત્રીની કાર્યશૈલી સામે તથા ભ્રષ્ટાચાર અને ગરીબી સામે સભામાં રાષ્ટ્રહિતમાં ટિપ્પણી કરતા હોય છે.

માલ્યા, મોદી, ચોક્સીનું 22,586 કરોડનું કૌભાંડ

3 ભાગેડુઓની કુલ 18,000 કરોડની સંપત્તિ જમ, 9371 કરોડ બેંકોને પરત : ઈડી

નવી દિલ્હી : નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યાએ આચરેલી છેતરપિંડીને કારણે થયેલા નુકસાન પૈકી ૪૦ ટકાથી વધુ નુકસાન વસુલ કરી લેવામાં આવ્યું છે તેમ ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઈડીના જણાવ્યા અનુસાર ટાંચમાં લેવામાં આવેલા શેર વેચી દેવામાં આવવાથી ૫૮૦૦ કરોડ રૂપિયા રિકવર થયા છે.



એજન્સીના જણાવ્યા અનુસાર આ ત્રણેય ભાગેડું આરોપીઓની ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિ વેચીને અત્યાર સુધીમાં ૮૩૭૧ કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. જે આ ત્રણેયને કારણે થયેલા કુલ નુકસાન ૨૨,૫૮૬ કરોડ રૂપિયાના ૪૦ ટકાથી વધારે થાય છે. આ ઘટનાક્રમ અંગે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને ટ્વિટર પર જણાવ્યું છે કે ભાગેડું અને આર્થિક અપરાધીઓ સામે કડક

પોલીસે લોકડાઉનનો ભંગ કરનારા બાળકોને નગ્ન કરી સરઘસ કાઢ્યું

ભોપાલ

દેશના ઘણા હિસ્સામાં હજી આંશિક લોકડાઉન લાગુ કરાયેલું જ છે. જેમાં મધ્યપ્રદેશનો પણ સમાવેશ થાય છે. જોકે અહીંની રાજધાની ભોપાલમાં લોકડાઉનનો ભંગ કરનારા બાળકોને પોલીસે વિચિત્ર સજા આપી હતી અને પોલીસના વલણની ટીકા પણ થઈ રહી છે. મળતી વિગતો પ્રમાણે ભોપાલના એક તળાવમાં રવિવારે કેટલાક બાળકો લોકડાઉનનો ભંગ કરીને નહાવા પડ્યા હતા. પોલીસે તળાવમાં કોઈ આત્મહત્યા ના કરે તે માટે તરવૈયાઓને તૈનાત કર્યા છે. આ તરવૈયાઓએ પોલીસની મદદથી નહાવા પડેલા બાળકોના કપડા

છુપાવી દીધા હતા અને એ પછી પોલીસે કપડા વગર જ નગ્ન હાલતમાં બાળકોનું સરઘસ કાઢ્યું હતું. આવી જ સ્થિતિમાં પોલીસે બાળકો પાસે ઉઠ બેસ પણ કરાવી હતી. જ્યારે તરવૈયાઓએ તેમના વિડિયો પણ ઉતાર્યા હતા. લોકડાઉનનો ભંગ કરનારાઓને પોલીસ ક્યારેક અલગ અલગ પ્રકારની સજા આપતી હોય છે પણ બાળકોનું નગ્ન હાલતમાં સરઘસ કાઢવાની સજા ઘણાને યોગ્ય લાગી નથી. પોલીસે રસ્તા પર તેમને કપડા પહેર્યા વગર ચલાવ્યા હતા. જોકે આ મામલામાં પોલીસ સામે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ હોવાના અહેવાલ જાણવા મળ્યા નથી.

2020માં ભારતમાં ૬૪ અબજ ડોલરનું FDI ઠલવાયું, વિશ્વમાં પાંચમાં ક્રમાંકે

ભારતને કારણે દ. એશિયામાં એફડીઆઇ 20 ટકા વધીને 71 અબજ ડોલર નવ દિલ્હી

કોરોના સંકટકાળ દરમિયાન પણ ભારત વિદેશમાંથી સીધું મૂડીરોકાણ આકર્ષવામાં સફળ રહ્યું છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન ભારતમાં ૬૪ અબજ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) આવ્યું છે અને આ સાથે વિદેશી મૂડીરોકાણના મામલે ભારત સમગ્ર દુનિયામાં પાંચમા સ્થાને રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯ દરમિયાન ભારતમાં ૫૧ અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું હતું. આ વાત સંયુક્ત



રાષ્ટ્ર (યુએન)ના એક અહેવાલમાં સામે આવી છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપની આર્થિક ગતિવિધીઓ પર ગંભીર અસર થઈ છે, પરંતુ

મજબૂત માળખાંગત પરિબલોએ મધ્યમ સમયગાળા માટે આશાવાદ ટકાવી રાખ્યો છે. વેપાર અને વિકાસ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દ્વારા આજે સોમવારે જારી કરાયેલ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ ૨૦૨૧માં જણાવ્યું છે કે વૈશ્વિક એફડીઆઈ મૂડીપ્રવાહને મહામારીથી ગંભીર અસર થઈ છે. જેના કારણે વૈશ્વિક મૂડી પ્રવાહ વર્ષ ૨૦૨૦માં ૩૫ ટકા ઘટીને ૧૫૦૦ અબજ ડોલરથી ઘટીને ૧૦૦૦ અબજ ડોલર નોંધાયું છે.

આંધ્રપ્રદેશમાં કોરોનાના ૩૨થી માતા અને પિતાએ બાળકો સહિત આપઘાત કર્યો

સગા સંબંધીઓ કોરોનામાં માર્યા ગયા હોવાથી કોરોના સંક્રમણનો ડર લાગતો હતો

નવી દિલ્હી

આંધ્ર પ્રદેશમાં 4 લોકોના સમગ્ર પરિવારે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મહત્યા ઉપરાંત આત્મહત્યા કરવા પાછળનું કારણ પણ ખૂબ જ ચોંકાવનારું છે. પ્રાથમિક તપાસમાં એક સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં કોરોના વાયરસ થવાનો ડર હોવાથી જીવ આપી દીધો તેમ લખેલું હતું. કનૂલ શહેરના વડગેરી ખાતે આ ઘટના બની હતી. પરિવારના 4

સદસ્યો જેમાં પતિ અને પત્ની ઉપરાંત તેમના 17 અને 14 વર્ષની ઉમરના બાળકોનો પણ સમાવેશ થાય છે તેમણે ઝેર ખાઈને જીવ આપી દીધો હતો. ઘરમાંથી ચારેય વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક પ્રતાપ એક ટીવી મિકેનિક હતા જ્યારે દીકરો જયંક કોઈક કોર્સનો અભ્યાસ કરી રહ્યો હતો અને દીકરી સાતમા ધોરણમાં હતી. બુધવારે ઘણા કલાકથી પરિવારનું કોઈ સદસ્ય બહાર ન નીકળતા પાડોશીઓને શંકા જાગી હતી. પાડોશીઓએ બારણું

ખખડાવ્યું હતું પરંતુ કોઈ જવાબ ન મળતા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે બારણું ખોલ્યું તો અંદર ચારેય વ્યક્તિના મૃતદેહ જમીન પર પડેલા હતા. આ ઉપરાંત ઘરમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, કોરોનાના કારણે મિત્રો અને સગા સંબંધીઓના મોત થયા હતા અને તેમને સંક્રમણનો ડર લાગતો હતો. પોલીસે ચારેય મૃતદેહ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

પૂર્વ PM દેવગૌડાએ માનહાનિના કેસમાં રૂ. બે કરોડ ચૂકવવા પડશે

બેંગલુરુ

ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ માનહાનિના કેસમાં બે કરોડ ચૂકવવા પડશે. બેંગલુરુની એક કોર્ટે ૨૦૧૧ના કેસના સંદર્ભમાં ચુકાદો આપતા દેવગૌડાએ આ ચૂકવણી કરવાની આવી છે. કોર્ટે દેવગૌડાને ૨૦૧૧ના કેસમાં એક ટીવી મુલાકાતમાં નંદી ઇન્ફાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇઝિસ (એનઆઈસીઈ) સામે કરેલી અપમાનજનક ટિપ્પણી માટે બે કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રકારનો આદેશ તેવા રાજકારણીઓ માટે પદાર્થપાઠ છે જે કોઈપણ પ્રકારના તથ્ય વગર ખાનગી

ક્ષેત્રની કંપનીઓ પર આરોપ મૂકે છે. એનઆઈસીઈના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર અશોક ખેની છે, જે બિદર દક્ષિણના ભૂતપૂર્વ વિધાનસભ્ય પણ છે. ૨૮ જૂન ૨૦૧૧ના રોજ ગૌડા ગર્જનના શીર્ષક હેઠળ એક કમ્પેનિસમાચર ચેનલ પર પ્રસારિત કાર્યક્રમને ટાંકીને ગૌડાને કોર્ટે બે કરોડની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો. તેમા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના લીધે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. વાસ્તવમાં જેડીએસના વડાએ એનઆઈસીઈની એક યોજના અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને લૂંટ કહી હતી.

જમ્મુ કાશ્મીરથી 135 કરોડ રૂપિયાનું હેરોઈન જમ, 1 તસ્કર ઠાર મરાયો

નવી દિલ્હી

સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીર ખાતે ભારે મોટી સફળતા હાથ લાગી છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ બુધવારે કહુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે માદક પદાર્થોની તસ્કરી કરી રહેલા એક શખ્સને ઠાર માર્યો હતો. તે વ્યક્તિ પાસેથી આશરે 135 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતું હેરોઈન પણ જમ કરવામાં આવ્યું છે. બીએસએફના કર્મીઓએ તસ્કરને સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતા જોયો હતો અને તેને ચેતવણી પણ આપી હતી. તેમ છતાં તે માન્યો નહોતો અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો જેથી ગોળી ચલાવવી પડી હતી. હજુ સુધી મૃત તસ્કરની કોઈ ઓળખ સામે નથી આવી.

સિદ્ધુને નાયબ મુખ્ય પ્રધાન નહીં બનાવાય : કેપ્ટન અમરિંદર સિંહ

નવી દિલ્હી

ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુના સતત શાબ્દિક પ્રહારો સહન કરી રહેલા અને ધારાસભ્ય પુત્રોને સરકારી નોકરી આપવા બદલ પોતાની જ પાર્ટીમાં ટીકાઓનો સામનો કરી રહેલા પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે મંગળવારે નવી દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિની સાથે બેઠક કરી હતી. એવું જાણવા મળ્યું છે કે આ બેઠક દરમિયાન ત્રણ સભ્યોની કમિટીએ મુખ્ય પ્રધાન સાથે પંજાબની રાજકીય



પરિસ્થિતિ, કોંગ્રેસ પાર્ટીની આગામી ચૂંટણી અને નવજોતસિંહ સિદ્ધુ પ્રકરણ અંગેની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સમિતિએ મોટાભાગના મુદ્દાઓના સમાધાન શોધવાની જવાબદારી મુખ્ય પ્રધાનને સોંપી છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડથી ત્રણ હુમલા, બેની હત્યા


શ્રીનગર

જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં પોલીસ અને સીઆરપીએફની નાકા પાર્ટી પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે શ્રીનગરમાં આતંકીઓએ હુમલો કરીને એક નાગરિકની હત્યા કરી હતી. છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રીજો હુમલો છે. કાશ્મીર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. ગુરુવારે યોજનારી આ બેઠક પૂર્વે જ આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. આ પહેલા રાજપોર ચોકમાં આતંકીઓએ પોલીસ અને સીઆરપીએફ પાર્ટી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જે બાદ સુરક્ષા જવાનોએ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો.

UK, US, ભારત સહિત ૯ દેશોમાં ડેલ્ટા+ની હાજરી

વોશિંગ્ટન

કોરોના મહામારીની બીજી લહેર શાંત પડી ગઈ છે પરંતુ કોરોના નવા સ્વરૂપ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ચિંતા વધારી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ૯ દેશોમાં છે જેમાં યૂકે, યુએસ, જાપાન, રશિયા, ભારત, પૂર્તગાલ, સ્વિટ્ઝર્લેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે. ભારતમાં ડેલ્ટા પ્લસના 40 કેસ ધ્યાનમાં આવ્યા છે અને હજુ તેને વેરિએન્ટ ઓફ ઈન્ટરસ્ટની શ્રેણીમાં રાખવામાં આવે છે. ડેલ્ટા વેરિએન્ટના કેસ કેરલ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ધ્યાનમાં આવ્યા છે. દરેક રાજ્યોને પત્ર લખીને આ નવા વેરિએન્ટને કેવી રીતે કાબુમાં કરવો તે અંગે જણાવવામાં



આવ્યું છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કોઈ પણ ભોગે આગળ વધતો અટકાવવો છે.

નિષ્ણાતોનું પણ માનવું છે કે ડેલ્ટા વેરિએન્ટ ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા મુજબ ભારતની બંને વેકસિન કોવેકસિન અને કોવિશીલ્ડ ડેલ્ટા વેરિએન્ટ પર અસરકારક છે.

નીતિ આયોગના સભ્ય વી કે પોલે આ દરમિયાન જણાવ્યું કે કોરોના વાયરસની લહેર કોરોનો સક્રિય રહેવાથી આવે છે. જો આપણે તેની સામે પ્રોટેક્શન નહીં કરીએ તો ભોગ બનતા વાર લાગશે નહીં. જો વાયરસ સ્વરૂપ બદલી નાખે તો તે જોખમી સાબીત થાય છે આથી વાયરસને અનુકૂળ વાતાવરણ ઉભું થાય તેવો ચાન્સ જ નહીં આપવો તે એક માત્ર ઉપાય છે. ઘણા દેશોમાં ચાર વેવ આવી ગયા છે. કોરોનાની વેવને લઈને કશુંજ ભવિષ્ય ભાખવું અઘરું છે. જે લોકોએ કોરોનાની રસીના એક ડોઝ લીધો છે કે બે ડોઝ તેઓએ ભીડમાં જવું જોઈએ નહીં. છેવટે તો માણસનું સ્વાસ્થ્ય કેવું છે તેના પર જ બધું નિભર છે.

બ્રાઝિલમાં કોરોનાનો મૃત્યુઆંક 5 લાખને પાર : લોકો વિરોધમાં રસ્તા ઉતર્યા

કોરોનાના કારણે સૌથી અસરગ્રસ્ત થનારા દેશોમાં અમેરિકા અને ભારત બાદ બ્રાઝિલનું સ્થાન છે. બ્રાઝિલમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં પાંચ લાખથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. અત્યંત ધીમે વેક્સિનેશન અને સરકારની ટીલભરી નીતિના કારણે આ લોકોના મૃત્યુ થયા હોવાના આકોશ સાથે ત્યાંના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારો સામે વિરોધ કરવા હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા અને સૂત્રો પોકાર્યા હતા કે આ એક પ્રકારનો નરસંહાર છે અને રાષ્ટ્રપતિ બોલ્સોનારો આ નરસંહાર માટે જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે લેટિન અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુ બ્રાઝિલમાં નોંધાયા છે. પાંચ લાખના મૃત્યુઆંક સાથે બ્રાઝિલ અમેરિકા બાદ વિશ્વમાં બીજા સ્થાને છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 1,78,83,750 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

એન્ટીવાયરસ કંપનીના ફાઉન્ડર જોન મૈકેફીએ જેલમાં ફાંસો ખાધો

ન્યૂયોર્ક

અમેરિકા ટેકનોલોજી એન્ટરપ્રેન્ચર અને એન્ટીવાયરસના ગુરુ ગણાતા જોન મૈકેફીએ બુધવારે પોતાના પ્રિઝન સેલ એટલે કે જેલની કોટડીમાં ફાંસી લગાવી લીધી હતી. તેમના વકીલ જેવિયર વિલાલબાસે જણાવ્યું કે, સ્પેનની કોર્ટે જોન મૈકેફીને સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી હતી અને તેના બાદ તેમણે આ પગલું ભર્યું હતું.

જોન મૈકેફી પાસે પોતાના ઉપર લાગેલા આરોપો વિરૂદ્ધ અપીલ કરવાનો વિકલ્પ હતો પરંતુ તેઓ

જેલમાં વધુ દિવસ રહી ન શક્યા. જેલ પ્રશાસન હાલ તેમના મૃત્યુના કારણને શોધવા પ્રયત્ન કરી રહ્યું છે. 1987માં વિશ્વનું પ્રથમ કોમર્શિયલ એન્ટીવાયરસ લોન્ચ કર્યું તે પહેલા મૈકેફી નાસા, જિરોક્સ, લોકહીડ માર્ટિન જેવી સંસ્થાઓ સાથે કામ કરી ચુક્યા હતા. તેમણે 2011માં પોતાની સોફ્ટવેર કંપની ઈન્ટેલ વેચી દીધી હતી અને હવે તેઓ આ વેપાર સાથે નહોતા જોડાયેલા. જોકે હજુ પણ તેમનું નામ સોફ્ટવેર સાથે સંકળાયેલું છે અને સમગ્ર વિશ્વમાં તેના 500 મિલિયન યુઝર્સ છે.

USના અલાબામાં ક્લોડેટ વાવાઝોડાને પગલે 12 લોકોનાં મોત, મકાનો ધરાશાયી

એટલાન્ટા

અમેરિકાના અલાબામાં ઉષ્ણકટીબંધીય વાવાઝોડું ક્લોડેટને પગલે 12 લોકોનાં મોત થયા છે. અમેરિકાના દક્ષિણ પૂર્વના રાજ્યોમાં આ તોફાનને કારણે સૌથી વધુ નુકસાન થયું છે. વરસાદ અને તોફાનને કારણે મોટી સંખ્યામાં મકાનો નાશ પામ્યા છે.

બે વાહનો કેશ થતાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે જેમાં 9 બાળકો સામેલ છે. આ ઘટનામાં કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં



દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તુસ્કાલૂસા શહેરમાં એક મકાન પર વૃક્ષ પડતા 24 વર્ષના એક યુવાન તથા 3 વર્ષના બાળકનું મોત થયું છે. જો કે પીડિતોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

મિસીસિપ્પીના ગલ્ફ કોસ્ટમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો. તોફાનને કારણે સૌથી વધુ નુકસાન અલાબામાં અને જ્યોર્જિયામાં થયો છે. આ તોફાનની અસર ઉત્તર કોરોલિનાથી લઈને ડક ટાઉન સુધી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે.

સોમવારે આ તોફાન ઉત્તર કોરોલિના તરફ વળે તેવી શક્યતા છે. અલાબામાં નોર્થપોર્ટમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.

અમેરિકા-મેક્સિકો સરહદ નજીક ભીષણ હિંસા થતા 18 નાગરિકોના મોત નીપજ્યાં

મેક્સિકો

અમેરિકાની સરહદ પાસે મેક્સિકન સિટીના રેનોસા ખાતે અનેક ગાડીઓ પર સવાર હુમલાખોરોએ સામાન્ય લોકો પર આડેપડ ગોળીઓ વરસાવી હતી. આ હિંસક ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. જાણવા મળ્યા મુજબ હથિયારોથી સજ્જ શપ્સ ગાડીઓ પર સવાર હતા અને તેમણે સામાન્ય લોકો પર ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી હતી.

સુરક્ષા દળોના કહેવા પ્રમાણે આ



ઘટના બાદ અફરા-તફરી મચી ગઈ હતી. સુરક્ષાદળોએ 4 શકમંદોના ઠીમ ઢાળી દીધા હતા. તેમાં બોર્ડર બ્રિજ પાસે માર્યા ગયેલા શપ્સનો પણ સમાવેશ થાય છે. આ હુમલો શનિવારે બપોરે શરૂ થયો હતો. સોશિયલ

મીડિયા પર જાહેર તસવીરોમાં રેનોસાની ગલીઓમાં લાશો છવાયેલી નજરે ચડી રહી છે.

રેનોસાના મેયર માકી એસ્તેર ઓર્ટિજ ડોમિંગુએજે ટ્વીટર પર નાગરિકોની સુરક્ષાની માગણી કરી છે. તામાઉલિપાસના ગવર્નર ફાંસિસ્કો ગ્રેસિયા કાબેજા ડે વાકાએ રવિવારે આ ઘટનાની નિંદા કરી હતી અને માર્યા ગયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ હુમલા પાછળના ઉદ્દેશ્યની તપાસ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી.

H1-B વિઝાની સંખ્યા બમણી કરવા US ચેમ્બર ઓફ કોમર્સની માંગણી

વોશિંગ્ટન

અમેરિકામાં સ્કીલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓની ભારે અછત વર્તાઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને યુએસ ચેમ્બર ઓફ કોમર્સે બાઈડેન વહીવટી તંત્ર અને અમેરિકન સંસદને એચ-૧બી વિઝાની સંખ્યા બમણી કરવા અને ગ્રીન કાર્ડ માટે દરેક દેશના નિયત ક્વોટાને પણ સમાપ્ત કરવાની માંગ કરી છે. અમેરિકાની આઈટી કંપનીઓ ભારત અને ચીનમાંથી મોટા પ્રમાણમાં આઈટી પ્રોફેશનલોને એચ-૧બી વિઝા હેઠળ નોકરી પર રાખે છે. હાલમાં અમેરિકા દર વર્ષે ૬૫,૦૦૦ વિદેશી કર્મચારીઓને

એચ-૧બી વિઝા આપે છે. આ ઉપરાંત અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરનારા વિદેશીઓ માટે અલગથી ૨૦,૦૦૦ એચ-૧બી વિઝા ઈશ્યુ કરવામાં આવે છે. યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે માગ કરી છે કે એચ-૧બી વિઝાના ક્વોટાને વધારવામાં આવે જે હાલમાં ૬૫,૦૦૦ છે. આ ઉપરાંત તેણે માગ કરી છે કે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરનારા વિદેશીઓ માટેના ક્વોટામાં વધુ ૨૦,૦૦૦ કરવામાં આવે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ સુઝાન કર્લાકના જણાવ્યા અનુસાર અમેરિકા માટે આગળ વધવા માટેનો આ યોગ્ય સમય છે.

ઉત્તર કોરિયામાં મોબાઈલ વાપરવા બદલ કિંમ જોંગે ૧૦ને મોતની સજા આપી

સિઓલ

દુનિયાના સૌથી સનકી શાસક ગણાતા કિમ જોંગુ મગજ ક્યારે પિત્તો ગુમાવશે તે કોઈ કહી શકતું નથી. હવે એવા અહેવાલો આવ્યા છે કે, મોબાઈલ વાપરવા બદલ કિમ જોંગે ૧૦ નાગરિકોને મોતની સજા આપી છે. આ નાગરિકોએ ચીનના મોબાઈલ નેટવર્ક થકી બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી. ઉત્તર કોરિયામાં ચીનના મોબાઈલ નેટવર્કના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે અને આ પ્રતિબંધનો ભંગ કરવા બદલ આ 10 નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એવું મનાય છે કે, નોર્થ કોરિયાની સત્તાધારી પાર્ટીએ ૧૫૦ લોકોને પકડ્યા હતા.

વિશ્વની ૧૦૦ બ્રાન્ડમાં એમેઝોન પ્રથમ, એપલ બીજા અને ગૂગલ ત્રીજા ક્રમાંકે

ભારતની ત્રણ કંપની ટીસીએસ, HDFC અને LICનો સમાવેશ

વોશિંગ્ટન

એમેઝોન અને એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. જો કે ચીનની બ્રાન્ડ્સ આ બાબતમાં સતત આગળ વધી રહી છે તેમ બ્રાન્ડથી જોડાયેલા એક તાજેતરના રેન્કિંગમાં આ વાત જણાવવામાં આવી છે. કાન્ટાર બ્રાન્ડઝેડના રેન્કિંગ અનુસાર વેલ્યુની દ્રષ્ટિએ ચીનની બ્રાન્ડ્સ યુરોપની ટોચની બ્રાન્ડથી આગળ નીકળી ગઈ છે. એમેઝોન વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની રહી છે. એમેઝોનની બ્રાન્ડ



વેલ્યુ ૬૮૪ બિલિયન ડોલર છે. આ રેન્કિંગમાં ગૂગલ ૪૫૮ અબજ ડોલરની વેલ્યુ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. યાદીમાં ભારતની ત્રણ કંપની ટીસીએસ, HDFC, LICને સ્થાન મળ્યું છે

પાક.માં બાજવાની હત્યાનું કાવતરું, 14 અધિકારીની ધરપકડના દાવાથી હડકંપ

ઈસ્લામાબાદ

પાકિસ્તાનની સેનામાં જ આંતરિક ડખા સર્જાયા હોવાનું બહાર આવ્યા બાદ પાકિસ્તાની સરકારની ઉંચ ઉડી ગઈ છે. પાક. સેનાના પ્રમુખ જનરલ કમર બાજવાની હત્યાનું કાવતરું ઘડવા બદલ સેનાના કેટલાક અધિકારીઓ અને જવાનોની ધરપકડ કરવામાં આવી છે. જો બાજવાની હત્યા થઈ હોત તો પાકિસ્તાનમાં સ્થિતિ વધારે બગડી હોત. બાજવાની હત્યાના ઘડયંત્રનો દાવો પાક કબજા હેઠળના કાશ્મીરના એક્ટિવિસ્ટ અમજદ અયૂબ મિર્ઝાએ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે બાજવા પર હુમલો કરવામાં આવનાર હતો પણ એ પહેલા જ આ કાવતરાની ગંધ આવી જતાં કેટલાક અધિકારીઓ અને જવાનોની ધરપકડ કરવામાં આવી છે.



ભારતને હરાવી ન્યૂઝીલેન્ડ બન્યું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન

ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 કારણો

- 1 પહેલી ઇનિંગમાં ભારતીય ઓપનર્સ ટીમને સારી શરૂઆત કરાવી પરંતુ બીજી ઇનિંગમાં બેટ્સમેનો ચાલ્યા નહીં.
- 2 ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અર્જુન સુપ્તેને જેવા સ્ટાર બેટ્સમેન સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થયા.
- 3 રવિન્દ્ર જાડેજા બોલ અને બેટ બંનેમાં કમાલ કરી શક્યો નહીં.
- 4 ઈશાત, બુમરાહ, અને શમી પ્રણેય પાસે સારા પ્રદર્શનની આશા હતી. પરંતુ પ્રણેય બોલરોનું પ્રદર્શન નબળું રહ્યું.
- 5 પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની અંતિમ ત્રણ વિકેટે 57 બોડ્યા જેનાથી ન્યૂઝીલેન્ડ ટીમ લીડ મેળવવામાં સફળ રહી.

ભારતને 8 વિકેટે હરાવ્યું: ન્યૂઝીલેન્ડની ટીમે 91 વર્ષમાં પ્રથમવાર ICC ટ્રોફી જીતી

સાઉથમ્પ્ટન

ક્રીવી ટીમે પ્રથમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. ભારતને હરાવીને હવે ક્રીવી ટીમે પ્રથમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડ ટીમ ઈન્ડિયા અને કરોડો ભારતીયોનું ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ટાઈટલ મેચમાં ક્રીવીએ ભારતને 8 વિકેટથી હરાવ્યું. ભારતે બીજી ઇનિંગના આધારે 139 રનનો સરળ લક્ષ્યાંક આપ્યો હતો. ક્રીવીની ટીમે આ રન 45.5 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર રન બનાવીને જીતી લીધો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડ WTC જીતનાર

કોહલીએ પૂજારા ઉપર નિશાન તાક્યું, કેટલાક ખેલાડી રન બનાવવાનું ઝનૂન દેખાડતા નથી

સાઉથમ્પ્ટન: ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય સુક્રાની વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાં ફેરફાર થાય તેવા સંકેત આપ્યા છે. કોહલીએ જણાવ્યું હતું કે સમીક્ષા કર્યા બાદ સારા પ્રદર્શન માટે સકારાત્મક માનસિકતા સામે મેદાનમાં ઉતરે તેવા ખેલાડીઓને ટીમમાં લાવવામાં આવશે. કોહલીએ કોઈ વ્યક્તિગત ખેલાડીનું નામ લીધું નહોતું પરંતુ સંકેત આપ્યો હતો કે કેટલાક ખેલાડીઓ રન બનાવવાનું ઝનૂન દેખાડતા નથી. કોહલીનો આ સંકેત સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા સામે થયો હોવાનું માનવામાં આવે છે જેણે ફાઇનલના પ્રથમ દાવમાં ૫૪ બોલમાં આઠ તથા બીજા દાવમાં ૮૦ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા. તેણે પ્રથમ રન માટે ૩૫ બોલનો સમય લીધો હતો.

પ્રથમ ટીમ હોવાનું ગૌરવ પોતાના ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચની નામે કર્યું છે. સાઉથમ્પ્ટનમાં રમાતા

બીજી ઇનિંગમાં ભારતના બેટ્સમેનોનું પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું હતું. છઠ્ઠા દિવસના રિઝર્વ દિવસે શરૂ થયેલી રમતમાં ટીમ ઈન્ડિયા 170 રનો પર ઓલ આઉટ થઈ ગઈ હતી. હવે ન્યૂઝીલેન્ડને આ મેચ જીતવા માટે 139 રન બનાવવાના હતા. ભારત તરફથી ઋષભ પંતે સૌથી વધારે 41 રન બનાવ્યા હતા. અને વિરાટ 13, રોહિત 30, પુજારા-રહાણે 15, જાડેજા 16 રને આઉટ થયા હતા. જ્યારે ક્રીવી તરફથી સાઉદીએ 4, બોલ્ટે 3, જેમિસને 2 અને વેગનરે 1 વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમે 2 વિકેટ ગુમાવી 139 રનનો સ્કોર આસાનીથી પાર કરી મેચ જીતી લીધી હતી.

HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.



CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- Free Staging
- Free Professional Photography & virtual tour
- Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- Free Comparative Market Analysis
- Team of Professional for same price as hiring a single realtor
- Over 15 years of combined experience



3 BED. AND 2 WASH.
Spacious and beautifully renovated unit, ready to move in, \$\$\$ spent on renovations from new floorings to bathrooms, painting, light fixtures, electrical, appliances and much more. Won't last long. Very well maintained and quiet building. Conveniently located near 401, Pickering Mall, Lake, Parks, schools.



3 BED. AND 3 WASH.
Gorgeous Under 5Year Old 3 Bed/3 Bath Freehold Townhome, In High Demand Windfields Community Of Oshawa. Upgrades Include, Hardwood On Main Floor, Hardwood Stairs W/Iron Pickets, Espresso Kitchen Cabinets W/Glass Insert & Freshly Painted, Attached One Car Garage/2 Car Parking On Driveway, Walking Distance To Oshawa Transit, Durham College & Ontario Tech, New Rio-Can Mall, Min To 407, Future School Coming Across The Street.

- No Pressure
- No Obligation
- Just Answers to Your Questions...Its that Simple!

You have Nothing to Loose...Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team, Because...Teamwork Makes Your Dreams Work !

Shamim & Amin Kharodia
Broker of Record / Sales Representative
teamkharodia@gmail.com

300-2855 Markham Rd Toronto ON M1X 0C3


D: (647) 501-6786 | D: (647) 308-2941

F : (416) 298-8303 | P: (647) 666-8676





CLUB CERAMIC



Lapoto Finish



Matt Fiish

પોર્સેલિન
ટાઈલ્સ શરૂ થાય
છે ફક્ત
\$ 0.89 થીPorcelain tiles starting from
\$0.89 per square
feet onlyCeramic tiles starting from
\$0.50 per square
feet onlyસિરામિક
ટાઈલ્સ શરૂ
થાય છે
\$ 0.50 થી

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking

- ◆ પોર્સેલિન ટાઈલ્સ અને સિરામિક ટાઈલ્સ ફેક્ટરી ભાવે મળશે
- ◆ અમારા ભાવની ખાત્રી કરી શકો છો. વધારાના ૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે
- ◆ ફ્લોર, દિવાલ અને આઉટડોર પાર્કિંગની ટાઈલ્સ મળશે

-: Available Size :-

24" * 24" | 12" * 24" | 24" * 48" | 4" * 8" | 4" * 12"

MONTREAL

3590, Rue Griffith, Saint Laurent, QC, H4T 1A7
Phone: +1-514-260-2242 /
+1-514-813-3850

OTTAWA

Unit #4+5, 200 Colonnade Road,
Nepean, ON, K2E 7M1
+1-613-601-1474

MISSISSUAGA

5030 Maingate Drive, Unit#1, Mississauga, L4W 1X5
Phone: +1 (647) 527-6030 /
+1-514-813-3850<https://clubceramic.com> Email : sales@clubceramic.com

MOTEL for SALE

NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.comWebsite: <https://niraj-pancholi.c21.ca/>Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings**MOTEL KING : Specializing in Selling Motels: LIST & SELL with confidence**18 Room Motel Near Pembroke - \$925,000
1.5 hrs from Ottawa / 4 hrs from GTA14 Room Motel Near Ottawa - \$999,000
Within the city, 4 rooms with full kitchenette
Low operating costs. All amenities near by42 Room Motel Near Timmins - \$1,300,000
On Hwy 11, Within the city, indoor corridor27 Room Motel in Thunder Bay - \$1,999,000
60 Room Motel in Thunder Bay - \$2,000,000Small to Mid-Size Motels in Northern Ontario
Price: \$1,300,000 to \$2,000,00030+ Room Motel Near Sudbury - \$2,000,000
VTB available, 40% down payment require from buyerOther 15 to 40 Room motels coming up for sale
Price: \$1M to \$3.5M - Buyers with 40% down, get readyRecently SOLD Motels Near
Welland, London, Sarnia, North Bay, Cochrane, Sudbury**Motel Job or Working Partner opportunity**

@ Experienced Motel Operator: to run motel in northern Ontario, English & computer knowledge require. Good salary.

@ Working Partner: willing to invest minimum \$200K, offering 25% to 50% partnership + management salary to run the motel in north

SERIOUS BUYERS: you must need about 35% down payment & to sign buyer representation agreement.
Call for personal meeting to see motel's financial & to discuss mortgage options. Private finance available.

Century 21 People's Choice Realty Inc., 120 Matheson Blvd E, Unit 103, Mississauga, L4Z 1X1 Office Ph.: 905-366-8100